

ॐ

૧૨


૧૩

॥ तत्त्वय वाचकः प्रणवः ॥

# સતમભરા

આત્મનો હિતાય જગતઃ સુખાય

૧૪



વર્ષ - ૨૬ (ઓક્ટો, નવે, ડિસે.)

VOL - XXVI | 2009-2010

ISSUE-II

માનદ્દ, તંગી - નૈપદ્ય વ્યાસ

સંકલન - ડૉ. સ. સ. બિલ્કુ

‘યોગ’ ભિક્ષા લાવીએં, ‘ભિલ્કુ’ બની ગુરુઢાર:  
મુમુક્ષુ જરૂર પામશે, સૌનો મુજમાં ભાગ.

૧૫

# વિશેલાં મોતીડાં

-યોગભિન્ન

## સમજુ અને અકડુ

સમજુભાઈ અને અકડુભાઈ બને જિગરથન દોસ્ત હતા. બનેને એકબીજા વગર ઘડીભર ચાલે નહીં. પણ કંઈ અકળ કરણસર બનેમાં અબોલા થયા. એક સમજુ હતો અને બીજો અકડુ સ્વભાવનો હતો. સમજુએ વિચાર કર્યો કે “અબોલામાં બનેને નુક્સાન છે. અકડુને તો આવી સમજ પડવાની નથી માટે અબોલા મટાવાનો પ્રયત્ન મારે જ કરવો પડશે”. આમ વિચારી તેણે અકડુ સાથે કોઈપણ નિમિત્ત તેજું કરીને બોલવાનો પ્રયત્ન કરવા માંડ્યો. પણ અકડુ એટલે અકડુ. અભિમાન ને અજ્ઞાનમાં તે એમ માનવા લાગ્યો કે “હવે કેવો પૂછડી પટપટાવતો આવે છે! પણ હું બોલું ખરો? ના જ બોલું.” સમજુએ, સ્વમાન છાંડીને પણ ફરીફરીને તેની સાથે બોલવાના પ્રયત્નો કર્યા જ કથ્યો. “વાણિયાભાઈ! મુછ નીચ્યો.. તાં કંદે સાડી સાત વાર નીચ્યો.” એવી નીતિ અપનાવીને પ્રયત્નો કર્યા અને અંતે સફળ થયો. અને અબોલાના કારણે થનાર નુક્સાનથી પોતાને બનેને બચાવી લીધા.

## વગર પૈસે ધાન-પુષ્ય

કંઈ કહે કે “મારે પણ ખૂબ ધાન-પુષ્ય કરવું છે. પણ શું કરું? હું સાવ ગરીબ છું.” અરે ભાઈ! પેસા હોય તાં જ ધાન-પુષ્ય થઈ શકે તેવું નથી. “સમજુ” જેવી સમજશા રાખીને કુટુંબ અને સમાજમાં છવો તાં અને પણ ઘણું મોટું ધાન-પુષ્ય છે. આવા સૂક્ષ્મ રહસ્યમય ધાન-પુષ્યની તોલે બાજી કોઈ સ્થળ ધાન-પુષ્ય ન આવો શકે.

કંઈ કહે છે કે “મારે તો હિમાલયમાં જઈને ખૂબ ઉગ્ર તપ-સાધના કરવાં છે. પણ શું કરું? મારે ગૃહસ્થાશ્રમના વણી જવાબદારી નિભાવવાની છે.” અરે ભાઈ! તપ- સાધના કરવા માટે હિમાલયમાં જ જવાની કંઈ જરૂર નથી. તમે તમારા ધરમાં જ રહીને “સમજુ” જેવી સમજશા રાખો તો તે ઘણી મોટી સાધના છે. આવી સૂક્ષ્મ સાધનાની તોલે બીજી સાધના આવી શકે નહીં.

## સંતોની સજજનતા

સંત મહારાજ પોતાના પ્રવચનમાં, પોતાના નિદકને ખાસ આચહણ કરીને સભાની આગળ બેસાડે છે. એમ સમજુને કે જો આગળ બેસશે તો સત્સંગ બારાબર સંભળાશે-સમજાશે અને તેનું કલ્યાણ થશે. ત્યારે નિદક એમ સમજં છે કે સંત મહારાજ મૂર્ખ છે, મને મહા જ્ઞાની સમજુને આગળ બેસાડે છે, તેમને ખબર જ પડતી નથી કે હું તેમનો નિદક છું.

આવા મૂર્ખ, અજ્ઞાની અને અહંકારી જીવોનું કલ્યાણ કોણ કરી શકશે? કેવી રીતે કરી શકશે?

કથા પ્રસંગ નિમિત્ત	સ્થળ	તારીખ/સમય
ઓમુ ગુરુદેવ જયંતિ	કાન્નીભાઈ એ. પટેલ શાકુન્તલ બંગલોઝ ડોમન ખોટ, સત્તાધાર ચાર રસ્તા, ઘાટલોડિયા, અમદાવાદ-૩૧.	૧૩-૧૦-૦૬ મંગળવાર સાંજે ૪.૩૦ થી ૮
બંસતું વર્ષ	નૈષધભાઈ વ્યાસ ૩, ગંગાધર સોસાયટી, સરદાર પટેલ સ્કૂલ પાસે, મણીનગર, અમદાવાદ-૦૮.	૧૬-૧૦-૦૮ સોમવાર સવારે ૭ થી ૮

## ત્રણતમ્મરા

ત્રણતમ્મરા એટલે અનુભવયુક્ત સત્યથી ભરે લું  
બહુજનહિતાય - બહુજનમુખાય

### મુક્તા

પાતંજલ યોગદર્શન - સમાધિપાદ

- યોગભિકૃ

પતંજલિમુનિ એ યોગદર્શનના સમાધિપાદના ચાવીસથી ઓગણીસ સૂત્રોમાં ઈશ્વરની વાખ્યા કરી. ત્યારબાદ ત્રીસમા સૂત્રમાં ચિત્તને વિક્ષેપ કરનારા નવ અંતરાયો વિષે કહી રહ્યા છે.

વ્યાધિસ્ત્યાન સંશય પ્રમાદાલસ્યાવિરતિભાંતિદર્શના લબ્ધભૂમિકાત્ત્વાનવસ્થિતત્વાનિ ચિત્તવિક્ષેપા સ્તેતરાયા: ॥૩૦॥

ભાવાર્થ: વ્યાધિ, સ્ત્યાન, સંશય, પ્રમાદ, આલસ્ય, અવિરતિ, ભાંતિદર્શન, અલબ્ધભૂમિકાત્ત્વ અને અનવસ્થિતત્વ; આ નવ અંતરાયો ચિત્તનો વિક્ષેપ કરનારા છે.

પતંજલિમુનિએ અઠ્યાવીસમા સૂત્રમાં કહેલું કે ઓમ્ના સાર્થ જપથી અંતરાયોનો અભ્યાસ થઈ જાય છે. તેથી અંતરાયો ડેવા છે તેની થોડી વાત અહી ચચ્ચી છે. અંતરાયોને સારી રીતે સમજવા જોઈએ. કારણકે અંતરાયો દૂર ના કરી શકીએ તો સાધના થઈ શક નહી. કોઈ કહેશે કે “અમારે કયાં મોક્ષ મેળવવો છે કે સાધના કરવી છે? તે અંતરાયો આવવાના હતા! અને અંતરાયો ના આવે તો તેને દૂર કરવા માટે ઓમ્નો જપ કરવાની શી જરૂર છે?” તો તેનો ખુલાસો આ પ્રમાણે છે:

જીવન પણ મહાન સાધના છે. યોગ જીવનને માટે છે. તેથી શાંતિમય જીવન જીવવું હોય, મનુષ્યજીવન સાર્થક થાય તે રીતે જીવન વ્યતીત કરવું હોય, તો સાધનામય જીવન જીવવું પડશે, જીવનને પણ સાધના બનાવવી પડશે.

અંતરાયોને વિશદ્દરૂપે સમજાએ. નવ અંતરાયોમાંના પ્રથમ ત્રણ અંતરાયો વ્યાધિ, સ્ત્યાન અને સંશયને આપણે ગયા અંકમાં વિસ્તારથી સમજ્યા.

વ્યાધિ એટલે રોગ. રોગના અનેક પ્રકાર છે. તે બધા તન, મન અને બ્રહ્મ નામના ત્રણ પ્રકારમાં આવી જાય છે. તનના રોગ ટાળવા આપણે ડેક્ટર - વેદ - હકીમનો.

આશરો લઈએ છીએ. મનના રોગો માટે માનસિક-મનોવૈજ્ઞાનિક વિશેષજ્ઞોનો આશરો લેવાય છે. તન કરતાં મનના રોગ સૂક્ષ્મ છે. બ્રમનો રોગ વધુ સૂક્ષ્મ અને ગ્રૂચવણભર્યો છે. બ્રમરોગમાંથી મુક્ત કરવા માટે ખૂબ અનુભવી અને ધીરજવાળા મહાપુરુષની જરૂર પડે છે. ઉપરોક્ત ગ્રંથીય પ્રકારના રોગોનો “વ્યાધિમા” સમાવેશ થઈ જાય છે.

મનમાં ખોઢુ કરવાના સંકલ્પો ઉઠે, ખરાબ વર્તન કરવાના વિચારો આવે; અથવા તો મન-ચિત્ત ચેખ્યારહિત થઈ જવાના વિચારો કરે, કર્મ રહિત થવાના, પ્રમાદી થઈ જવાના સંકલ્પો આવ્યા કરે તેના માટે યોગશાસ્ત્રમાં સ્ત્યાન શાબ્દ વાપર્યો છે. સ્ત્યાન પણ એક અંતરાય છે.

ત્રીજો અંતરાય સંશય છે. સંશય શાબ્દ અતિ પ્રયત્નિત છે. શંકાઓ કરવી-સંશયો થવા કે આપણે યોગ વિશે જે કાંઈ સાંભળીએ છીએ તે સાચું હશે કે ખોઢુ હશે? આપણે જે સાધના કરીએ છીએ તેનાથી જે ફળપ્રાપ્તિ કરી છે તે થશે કે નહી તેવી શંકા - કુશંકાઓ થયા કરે તે, પણ એક અંતરાય છે.

ઉપરોક્ત ગ્રંથીય અંતરાયોને આપણે આગળના અંકમાં વિસ્તારથી સમજ ગયા છીએ. હવે બાકીના અંતરાયોને વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીએ.

પ્રમાદ અને આણસ : આ સૂત્રોમાં પ્રમાદ અને આણસ બે શાબ્દો આવ્યા છે. વ્યવહારમાં તો આપણે પ્રમાદ અને આણસ બંને શાબ્દોનો એક જ અર્થમાં ઉપયોગ કરીએ છીએ. પરંતુ અહી બંનેનો અર્થ જુદી છે. બંનેમાં સૂક્ષ્મ અંતર છે. પ્રમાદ એટલે યોગની સાધનાનું ચિત્તન ના કરવું. જે કાંઈ તાત્ત્વિક-સાત્ત્વિક સાંભળીએ તેનું ચિત્તન-મનન કરવું જોઈએ. આપણાં ઉષાબહેન અને રોહિતભાઈ આખો દિવસ કામ કરતાં પણ

યોગની કથા સાંભળે છે અને સતત તેનું ચિંતન-મનન કરે છે. ઉપાબહણ રાંધારાં હોય કે બીજું કાંઈ કાર્ય કરતાં હોય ત્યારે પણ તેમના લાથમાં યોગસૂત્રાનું પુસ્તક જોવા મળે છે. તેઓ તેમાંથી એક-એક સૂત્ર ગોખી- ગોખીને તેનો અર્થ સમજવાનો પ્રયત્ન કરતાં હોય છે. તો આનું નામ થયું ચિંતન. યોગની કથા તો સાંભળી પણ સાંભળ્યા પછી તે પ્રમાણે સાધના કરવી પડે, તેના માટે ઉત્સાહવાળા રહેવું પડે, પ્રમાદ ના ચાલે. યોગની સાધનાનું ચિંતન ના કરવું- યોગનાં અંગોના ચિંતનમાં આણસ કરવી તેનું નામ પ્રમાદ.

પ્રમાદ એ પણ આણસ તો ખરી જ. શામાં આણસ થવાથી તેને પ્રમાદ કહેવામાં આવે છે? યોગસાધનાના ચિંતનમાં જે આણસ કરવી તેનું નામ પ્રમાદ, અને ‘આણસ’ એટલે શરીરની આણસ, અર્થાત શરીરનો પ્રમાદ. વધુ ખાવાના કે બીજા કોઈ કારણે શરીરમાં ભારેપણું આવી જાય તેનું નામ આણસ. રોજ તો સૂત્રો ગોખવા બેસ્તા હોઈએ પણ તે દિવસે બગાસાં આવે, અંગો મરડતા રહીએ, સૂર્ય જાઉં-સૂર્ય જાઉં એમ થયા કરે અને ક્રિયા કરવાનો ઉત્સાહ ના રહે તે બધાં લક્ષ્યાં આણસનાં-આણસ અને પ્રમાદમાં આટલો સૂક્ષ્મ ફરક છે. બને આણસ જ છે. પણ સૂક્ષ્મ છે. અને બીજું સ્થૂળ. સ્થૂળ એટલે શરીરનાં આણસ-પ્રમાદ.

શરીરમાં ભારેપણું ઈત્યાદિ આવી જવાં તેનું નામ આણસ અને યોગનાં સૂક્ષ્મ સાધનાનું ચિંતન-મનન કરવામાં જે આણસ તેનું નામ પ્રમાદ. આણસનો સંબંધ સ્થૂળ શરીર સાથે છે અને પ્રમાદનો સંબંધ સૂક્ષ્મ મન સાથે છે.

**અવિરતિ:** આ બધાં શાનાં નામો છે? અંતરાયોનાં. યોગસાધનાકાળે, જીવનસાધના કાળે ચિત્તમાં જે જે અંતરાયો આવે છે તે અંતરોયોની વાત ચાલી રહી છે. અવિરતિ શાને કહેવામાં આવે છે? ચિત્તનું વિષયોના સંસર્ગો દ્વારા તેમાં મોહિત થઈ જનું તે અવિરતિ. વિષયો ભોગવવાથી ચિત્તમાં જે સંસ્કારો પડે છે તે આત્માને મોહિત-પ્રલોભિત કરી નાખે તેનું નામ અવિરતિ. વિષયભોગોથી થતા નુકસાનને ધ્યાનમાં રાખીને તેના તરફ ઉપરામવૃત્તિ કેળવવી જોઈએ. તેમ ના થાય અને તેમાં સતત લાલસા રહે કે ક્યારે અમુક વિષય મળે! ક્યારે અમુક વિષય ભોગવું! આમ સતત થયા કરવું તેનું નામ અવિરતિ. જીવ વિષયથી મોહાયેલો-લોભાયેલો રહે, ચિત્તમાં વિષયભોગના પદેલ સંસ્કારો જોર પકડી

જાય તે છે અવિરતિ નામનો અંતરાય.

અવિરત+ઈ અર્થात્ અવિરતિવાળી, એટલે કે વિષયભોગમાં અવિરત લાલસાવાળી વૃત્તિ. અસ્તુ.

**ભાંતિદર્શન:** જ્યાં સુધી ભાંતિમાં ભ્રમણામાં હોઈએ ત્યાં સુધી પણ શાંતિ પ્રાપ્ત કરી કે કરાવી શકતા નથી. તેથી ભાંતિદર્શનને પણ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. ભાંતિદર્શન એટલે ખોટું દેખાવું, ભાંતિદર્શન શબ્દ જ એવો છે કે જે ઘણી સહેલાઈથી સમજ શકાય છે. ભાંતિદર્શન અનંત પ્રકારનાં છે જેણો સમાવેશ નિઝનલિખિત ગ્રાન્ટ પ્રકારમાં કરી શકાય.

- (૧) જ્યાં કાંઈ જ ના હોય ત્યાં કાંઈક દેખાવું તે ‘મિથ્યાજ્ઞાન’ રૂપી ભાંતિદર્શન છે, જેમ કે મૃગજળ.
- (૨) હોય કાંઈ અને દેખાય કાંઈ તે ‘ભાંતિજ્ઞાન’ રૂપી ભાંતિદર્શન છે, જેમ કે જાડ ને બદલે માણસ દેખાય.
- (૩) જે હોય તેનાથી ઊલટું (વિપરીત) દેખાવું તે ‘વિપરીત જ્ઞાન’ રૂપી ભાંતિદર્શન છે; જેમકે રાતના બદલે દિવસ દેખાય.

ભાંતિદર્શન જીવનન્યવહારમાં પણ આવે છે અને સાધનામાં પણ આવે છે. પહેલાં જીવનન્યવહારમાં આવતા ભાંતિદર્શનને સમજુઓ.

આપણી માન્યતાઓ અને નિર્ણયો સાચા ના હોય ‘જે’ છે ‘તે’ નું જ્ઞાન, ‘જેમ’ છે ‘તેમ’ નું જ્ઞાન, ‘જેવું’ છે ‘તેવું’ નું જ્ઞાન અને ‘જ્યાં’ છે ‘ત્યાં’ નું જ્ઞાન આપણા મગજમાં કે હદ્યમાં ના હોય. ખોટા નિર્ણયો કરી લીધેલા હોય. જે જેમ છે તેને તેમ સમજ લીધું હોય તે સાચા નિર્ણયો છે. ઘણાં વર્ણાયી આપણા મગજમાં ખોટા નિર્ણયો આપણે પોતે અને બીજાઓએ ઘુસાડી દીધેલા હોય, અનેક ભ્રમણાઓ અને અસોઝ્ય માન્યતાઓ પેસી ગયેલ હોય તે બધાનું નામ ભાંતિદર્શન છે. લીમડો હોય તેને પીપળો માનતા હોઈએ એટલું જ નહીં પરંતુ અન્યો પણ તેને પીપળો જ કહે તેવો અત્યાગ્રહ - દુરાગ્રહ - હઠાગ્રહ રાયતા હોઈએ તેનું નામ ભાંતિદર્શન - જર્કી ભાંતિદર્શન.

હવે સાધનામાં આવતા ભાંતિદર્શનને સમજુઓ. ધ્યાનમાં અમુક ભૂમિકા એ ઊધની સૂક્ષ્મ અવસ્થા આવે છે. તે ગાઢી ઊધ નથી હોતી, ઊધની પ્રારંભિક અવસ્થા હોય છે. જાગૃત અવસ્થા હજુ પૂરી ધૂટી ના હોય અને નિદ્રા અવસ્થામાં હજુ પૂરી પ્રવેશયા ના હોઈએ તે વખતે જાગૃત અને નિદ્રા અવસ્થાનો સંચિકાળ આવે છે. હજુ તો સંચિકાળ પણ આવ્યો ના હોય તેવી અવસ્થા કે જેને

‘तंद्री’ कહી શકીએ. તેને તંદ્રા પણ કહી ના શકાય! પૂરા તંદ્રામાં પણ પ્રવેશ્યા ના હોઈએ, તંદ્રાથી પણ એક પગથિયું નીચેની અવસ્થા. તંદ્રીથી આગળ જઈએ ત્યારે તંદ્રા અવસ્થા અને ‘તંદ્રા’ થી આગળ જઈએ ત્યારે નિદ્રા અવસ્થા આવે. તો આમ, હજુ જગૃતમાંથી તંદ્રીમાં પ્રવેશ્યા હોઈએ ત્યારે નિદ્રા અવસ્થાની જેમ સ્વખો આવે છે. આસન લગાવી ને બેસીએ કે થોડી જ વારમાં તંદ્રી શરૂ થાય અને સ્વખોની જેમ વિવિધ દ્રશ્યો દેખાવ લાગે. લાંબા થઈને ઊઘતા હોઈએ અને જો દ્રશ્યો દેખાય તો તેને સ્વખો કહી શકીએ, પરંતુ આસન લગાવીને બેઠેલા હોઈએ ત્યારે આવાં દ્રશ્યો દેખાય તેથી તેને સાચાં માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. પછી આનંદાશ્રય સાથે કહીએ છીએ કે, “અરે વાહ! મને તો ધ્યાનમાં અમુક દેવનો સાક્ષાત્કાર થયો! મને તો અમુક મંત્ર મળ્યા! મને તો અમુક મહાત્માએ આશીર્વાદ આપ્યા” વગેરે. આ રીતે વર્ષો સુધી ભાંતિમાં જ રહીએ છીએ અને પછી તેની ટેવ પડી જાય છે. બ્રાહ્મસુહૂર્તમાં ઉઠીને જ્યાં આસન લગાવીને બેઠા કે તંદ્રી શરૂ! અને તંદ્રીમાં દર્શયોનો પ્રારંભ! અને આપણે તેને સાચાં માની લઈએ. આવું વર્ષો સુધી ચાલે! આ પણ એક ભાંતિદર્શન છે. આ કંઈ સમાવિજનિત દર્શયો નથી પણ તંદ્રાનિદ્રાજનિત દર્શયો છે, જેને આપણો સાચાં માની ને વર્ષો અને જન્મો સુધી છેતરાતા રહીએ છીએ! આ ભાંતિમાંથી આપણને કાઢવાની કોઈ ને લાગડી થાય તો આપણને તેનામાં વિશ્વાસ જ નથી હોતો, જેથી હમદર્દ અનુભવીઓ આપણા માટે કંઈજ પ્રયત્ન નથી કરી શકતા. આપણે તો એમજ માનતા રહીએ છીએ કે મને જે દેખાય છે તે જ બધું સાચું, મારો જ કક્ષો સાચો અને આશ્રયની વાત તો એ છે કે દીધી સમયની આદતના કારણે ભાંતિ મીઠી લાગે છે, તેમાંથી નીકળું પણ નથી ગમતું. આ પણ એક ધ્યાં મોટું ભાંતિદર્શન છે. તેને કૃપા અને કોશિશ દ્વારા ભગડીએ.

**અલબ્ધભૂમિકત્વ:** અલબ્ધભૂમિકત્વ એટલે ભૂમિકાઓનું અલબ્ધપણું. અલબ્ધ એટલે લબ્ધ ના થવું. લબ્ધ એટલે પ્રાપ્તિ અને અલબ્ધ એટલે અપ્રાપ્તિ. યોગસાધનામાં કમપૂર્વક એકાગ્રતાની ભૂમિકાઓની જે પ્રાપ્તિ થવી જોઈએ તે ના થાય, તેમાં આગળ ના વધાય તેનું નામ અલબ્ધભૂમિકત્વ નામનો અંતરાય.

ઓક્ટોબર-૨૦૦૮

**અનવસ્થિતત્વ:** અનવસ્થિતત્વ એટલે ભૂમિકાઓની પ્રાપ્તિ તો થાય, યોગમાં અનુકૂમે જે એકાગ્રતા પ્રાપ્તિ થવી જોઈએ તે પ્રાપ્ત તો થાય પરંતુ તે જેટલા સમય સુધી રામવી જરૂરી હોય તેટલા લાંબા સમય સુધી રહે નહીં, વહેલી તૂટી જાય. અમુક અનુભવ કરવા માટે અમુક સમય સુધીની એકાગ્રતા જરૂર હોય પણ તે વહેલી બંગ થઈ જાય તેથી તે અનુભવ થઈ શક નહીં. મહામહેનતે વૃત્તિને એકાગ્ર કરીને બેઠા હોઈએ, એકાગ્રતા અમુક સમય પૂર્તી તો જામી હોય, પણ ઈચ્છિત અનુભવ મેળવ્યા પૂર્વે જ તે વિખરાઈ જાય, અમુક અનુભવ થવા માટે જેટલા સમય સુધીની એકાગ્રતાની જરૂરત હતી તેટલા લાંબા સમય સુધી એકાગ્રતા ટડી નહીં તેથી અનુભવ થવો જોઈએ તે થયો નહીં આવી સ્થિતિનું નામ અનવસ્થિતત્વ નામનો ચિત્ત-અંતરાય. અસ્તુ.

તો આમ, પાતંજલ યોગદર્શનના સમાવિપાદના સૂત્ર ગ્રિસમાં આવતા નવ અંતરાયો- (૧) વ્યાવિ (૨) સ્ત્યાન (૩) સંશય (૪) પ્રમાદ (૫) આળસ (૬) અવિરતિ (૭) ભાંતિદર્શન (૮) અલબ્ધભૂમિકત્વ (૯) અનવસ્થિતત્વ - વિષે આપણે વિસ્તૃત માહિતી મેળવી.

જીવનસાધનામાં અને યોગસાધનામાં આ નવેય અંતરાયો આવે છે. જીવનનું નામ યોગ ભલે ના આપીએ પણ તે યોગ જ છે. જો સુખશાંતિપૂર્વક જીવનું હશે તો યોગની રીતે જ જીવનું પડશે. તેથી જીવન પણ સાધના બની જશે. અને જીવન જે સાધના બની જાય તો, જીવનસાધનામાં અંતરાયો આવશે જ. અને તો અંતરાયોને દૂર કરવા માટે ઓમ્રનો જાપ પણ કરવો પડશે. માટે અંતરાયોને વિશેદ્ધને સમજવા જોઈશે. આપણે ભલે યોગ ના સાધવો હોય, નિરાતે જીવન જ જીવનું હોય પણ જો તેમાં વ્યાવિ ઈત્યાદિ અંતરાયો આવે તો શું કરીએ? આપણે કોઈ ઉપરોક્ત નવ અંતરાયોને ઈચ્છીએ છીએ? ના. તો અંતરાયોને બરાબર “સમજી લઈને તે ને દૂર કરવા ઓમ્રનો-પ્રશાવનો જાપ કરવો જોઈએ. અસ્તુ.

(ક્રમશાસન)

“મુક્તા” પુસ્તકમાંથી સાભાર

ચિત્તન કરશે જે જેવું, આચરણ કરશે તે તેવું,  
આચરણ કરશે જે જેવું, સુખદુઃખ ભોગવશે તે તેવું.

# ગુરુપૂર્ણિમા મહોત્સવ

આલોચના: પ્રવિષ્ટભાઈ શાહ

ઓમ્પ્રચિવારનો ગુરુપૂર્ણિમા મહોત્સવ આ વખતે નારણપુરામાં અંકુર ચાર રસ્તા-કામેશ્વર મહાદેવના હોલમાં, પૂજયશ્રીની ઉપસ્થિતિમાં ખૂબ જ શ્રદ્ધા અને આનંદમય રીતે ઊજવાયો. તા. ૭-૭-૦૮ ને મંગળવાર ના રોજ સવારે બરાબર ૮૦૦ વાગે કાર્યક્રમની શરૂઆત શાંતિપાઠી થઈ. ઢોલક, મંજુરા અને ખજદીના તાલ સાથે લયબધ્ય રીતે પ્રશ્નવંદના-ગુરુઅષ્ટક-ગુરુમહિમા-સદ્ગોરાંની આરતી અને ગુરુગીતાના શ્લોકાનું ગાન કરવામાં આવ્યું. સમારોહનું સંચાલન ડોક્ટર સદ્ગુરુ સમર્પણ લિક્ષુજી કરતા હતા. સત્યધર્મગુરુ દેવકી જ્ય બોલાવીને તેમજો કહ્યું કે ઘણા સમયથી આપણે જે પર્વની ઊજવણી કરવાની આતુરતાપૂર્વક રાહ જોતા હતા, તે દિવસ -મહામૂલો અવસર આજે આપણને પ્રામ થયો. ગુરુપૂર્ણિમા એટલે ગુરુગ્રંથ ચુકવવાનો દિવસ, આપણે કલ્યાણમાર્ગમાં કેટલા આગળ વધ્યા તેનો કલાસ કાઢવાનો દિવસ, આપણી નૃતીઓ અને ખામીઓને નીરખવાનો દિવસ-આપણા પરમ શ્રદ્ધેય ગુરુદેવ સમક્ષ મનોમન આત્મનિવેદન કરવાનો દિવસ. આપણે ઘણાં વર્ષોની ગુરુપૂર્ણિમા ઊજવીએ છીએ. પહેલા આપણા કાર્યક્રમનો સમય સવારાના ૬૦૦ વાગ્યાનો રાખતા હતા. પછી ૭૦૦ વાગ્યાનો અને પછી ૭-૩૦ વાગ્યાનો રાખતા હતા, જેથી કરીને વધારે ગુરુપ્રેમીઓ સમયસર હાજરી આપી શકે. હોલમાં કાર્યક્રમ ૮૦૦ વાગે ચાલુ થાય એ રીતની ગોઠવણ કરી છે તો પણ ૩૦-૪૦ માણસી જ હાજર હોય છે. એટલે એમ કહી શકાય કે બાકીના ભક્તોને ગુરુપૂર્ણિમા પર્વની મહત્તમ ઓછી સમજઈ છે. જે લોકો બહારગામથી આવતા હોય કે ઘણો દૂર્થી આવતા હોય તેઓ મોડા પડે તો તે સમજી શકાય છે. કેટલાક ગુરુભાઈ-બહેનો તો કાર્યક્રમમાં હાજરી આપવા ખાસ બહારગામથી આગલે દિવસે અમદાવાદમાં આવી ગયા હોય છે, પણ તોય હોલ ઉપર સવારે ૮૦૦ વાગે પહોંચી શકતા નથી. તો સૈને ફરી ફરી ને વિનંતી છે કે કાર્યક્રમ શરૂ થાય-ત્યારે સેચા હાજર રહેવાનો પ્રયત્ન કરે.

ગુરુપૂર્ણિમાનું પર્વ એટલે આપણા ઉપર ઉપકારો કરનારાઓના ઋણમાંથી યથારાક્ષિત મુક્ત થવાનો દિવસ. મુખ્યત્વે- ગુરુ-સંતોનું ઋણ, માતા-પિતાનું ઋણ, ધર્તીમાતાનું ઋણ આપણે તન-મન-ધનથી આ ઓક્ટોબર-૨૦૦૮

સૌનાં ઋણમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ તો આ ગ્રણેયમાંથી એકેયનું ઋણ આપણે ચૂકવી શકીએ તેમ નથી પણ, ફૂલ નહી તો ફૂલની પાંખડી.

ભક્તોનું આગમન અને તેમને આવકારવાનું ચાલુ જ હતું. એ વખતે આપણા રાયમલભાઈ એમના રબારીના ટ્રેડિશનલ ડ્રેસમાં પરંપરાગત પહેરવેશમાં-હોલમાં પ્રવેશ્યા. ડોક્ટરસાહેબે હસીને મોટેથી જ્ય બોલાવી. સત્યધર્મગુરુ દેવકી જ્ય. શ્રી સદ્ગુરુ સમર્પણભિક્ષુજીએ પોતાની વાત આગળ ચલાવી- ઘણાં વર્ષો પછી આજે અહી ગામદેથી મારા સ્નેહીજનો, આમજનો ને હાજર રહેલો જોઈને, મને ઘણો જ આનંદ થાય છે. જૂની યાદો અને વીતી ગયેલા દિવસો યાદ આવે છે, ત્યારે તો અમારા સૈની ઉમર નાની હતી. પંડેરાવપુરા, ગોવિંદપુરા અને જ્યદેવપુરા આ બધા સ્નેહીજનો પુ. શ્રી ગુરુદેવની હાજરીમાં બેળા થતા રાતે વાળું-પાણી કરીને પછી ભજનોની રમજટ બોલાવતી. એક એકથી ચિદિયાતાં ભજનો સાંભળીને લાવવિભોર થઈ જવાતું, સવારે ૪૦૦ વાગ્યા સુધી આનંદ-મસ્તીમાં સમય વીતી જતો. આજે એ બધાં દ્રશ્યો આંખો આગળ તાજાં થાય છે.

એક-બે સ્વયંસેવક ભાઈઓ પ્રવેશદ્વાર આગળ અંદ્રોઅંદર મજાક-ટીખળ કરતા હતા. ડો. સદગુરુ સમર્પણ ભિક્ષુજીએ તેમને ટકોર કરી, આ સારી રીતભાત ના કહેવાય. આપણું વર્તન જો ગેરશિસ્તવાળું હોય તો સભામાં આવનારાઓ ઉપર તેની સારી છાપ ના પડે.

હવે બીજી-એક બે અગત્યની સૂચનાઓ. આપણા સદ્ગુર્યા પરમપૂજ્ય શ્રી ગુરુદેવ પદ્માર્વતાના છે. તેઓશ્રીની તબિયત નાદુરસ્ત હોવા છતાં આપણા સૈના આનંદ માટે-આપણા સૈના કલ્યાણ માટે. તેઓશ્રી પદ્માર્વતાના છે. તો આપણા સૈની એ ફરજ બને છે કે આપણે સૈન બરાબર શિસ્તમાં રહીએ. તેઓશ્રીની નજીક જઈને ચરણસ્પર્શ કરવાનો, માર્ગમાં આવીને નમસ્કાર કરવાનો કે મંચ ઉપર આવીને પગે લાગવાનો જોઈએ પણ પ્રયત્ન કરવાનો નથી.

બીજું આ વરસે ટ્રસ્ટની મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે કે 'ગુરુદેવની વાણી, પૂજયશ્રીનું સાહિત્ય-પુસ્તકો વધારે ને વધારે લોકો સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવા. ૨૧ પુસ્તકોનો સેટ ખરીદ તો અહીં કિમતે

આપવો. કોઈ ગુરુપ્રેમીને પોતાને ત્યાં સારા-માઠ પ્રસંગ હોય તારે આમજનોમાં વહેચવા માટે પુસ્તકો જોઈતા હોય તો કન્શેશન આપવું.

પૂજ્યશ્રી થોડા જ સમયમાં અતે આવી પહોંચે. ત્યાં સુધી આપણે શ્રી તુખારબાઈ પાસેથી એક- બે ભજન સાંભળીએ. સત્ય ધર્મગુરુદેવ કી જ્ય

શ્રી તુખારબાઈ એ —

'સવારી રે ચઢી સનાતન સંતની.....'

શ્રી મનીષભાઈ અને વિરેનભાઈ એ —

જે જે સાચી સમજ પામાય તે તે ગુરુપૂજન ગણાય.....

શ્રી કિરણભાઈ એ —

ચઢી આજ આનંદની હેલી કે ગુરુજીની પૂજા કરું કેવી....! વગેરે ભજનો ગાયા

૧૦:૪૫ વાગે શ્રી ગુરુદેવનું આગમન થયું. શશીકાન્તભાઈએ મોટા અવાજે ગુરુદેવના આગમનની છડી પોકારી. ડૉ. તિક્ષુજીએ ઊંચા અવાજે 'સત્યધર્મ ગુરુદેવકી જ્ય અને ઓમ નમ:પાર્વતીપતને હર....હર....મહાદેવ'નો જ્યઘોષ કર્યો સૌ ગુરુપ્રેમાઓએ હાથ ઊંચા કરી શ્રીગુરુદેવનું અભિવાદન કર્યું,

સૌને નમસ્કાર કરીને પૂ. ગુરુદેવ મંચ પર સ્થાન ગ્રહણ કર્યું. પરમાત્મીય ઉપસ્થિત સર્વે ને વંદન-અભિનંદન-આશિષ. ભક્તોથી ખીચોખીય ભરેલા હોલમાં આગંતુક ગુરુપ્રેમીઓ પર ચારે તરફ નજર ફેરવીને શ્રી ગુરુદેવે ખૂબ જ ભાવથી બધાંને યાદ કર્યા. વિજ્યભાઈ આવ્યા છે.? ખેડેરાવપુરાવાળા બળદેવભાઈ ક્યાં છે.? અનિલભાઈ પ્રજાપતિ આવ્યા છે.? એમના ઘરેથી કોઈ આવ્યું છે.? તેમની તબિયત કેવી છે.? ડાકોરથી કોણ કોણ આવ્યું છે.? 'ધર્મમેઘ'માં તો છ મહિનાથી રિવોલ્ટિંગ ચેરમાં બેસું છું. એટલે એની ટેવ પડી ગઈ છે. અહીંયાં એવી મુરશી હોત તો! સામે બેઠેલા તો સૌ દેખાય છે, પણ આજુબાજુ કે મંચની પાછળ બેઠેલાઓને જોઈ શકતા નથી - તેઓને પણ જોઈ શકત, મળી શકત.

તમને બધાને અહીં આવેલા જોઈને અમને ખૂબ આનંદ થાય છે. તબિયત નરમ-ગરમ રહેતી હોવા છતાં તમને બધાને મળવા માટે જ ખાસ આવા કાર્યક્રમોમાં અમે ઉપસ્થિત રહીએ છીએ. અહીં આવી શકીએ એટલા માટે પંદર-વીસ દિવસ અગાઉથી ખાવા-પીવામાં બેસવા-ઓક્ટોબર-૨૦૦૬

ઉઠવામાં નિયમન કરી લઈએ છીએ. તમારા બધાનો પ્રેમ અમને અહીં બેંચી લાવે છે. ગુરુપ્રેમ, સંતપ્રેમ, માતા-પિતાનો પ્રેમ, ભાઈ-ભાઈનો પ્રેમ, ભૈતિક પ્રેમ, આધ્યાત્મિક પ્રેમ. જેમ ભૌતિકતામાં સ્થિત રાખીએ છીએ તેમ આધ્યાત્મિકતામાં પણ રસ લેવો જોઈએ. આધ્યાત્મિક પ્રેમનું મૂલ્ય સમજાવું જોઈએ.

એક વખત સ્વામિનારાયણ ભગવાનને એક દરજાએ સરસ મજાની બંડી બનાવીને આપી. એક શેઠ દરજાને એવી બંડી એમના માટે પણ બનાવી આપવા કહ્યું. દરજાએ કહ્યું - 'શેઠ!' એવી બંડી આપના માટે તો ક્યાંથી બનાવી શકાય? આ તો મેં ભગવાન સ્વામિનારાયણ માટે બનાવી હતી અને એમાં તો ભાવ અને પ્રેમના ટાંકા લીધા છે.'

આ વખતે ગુરુપૂર્વિંમા ઉજવવાનું શ્રેય ખેડેરાવપુરાવાળા બળદેવભાઈએ લીધું છે. તેઓ અમને કહે - 'બાપુ!' "બીજી બધી રસોઈ ભલે અહીં હોલમાં બને, પણ લાહુ તો અમે ખેડેરાવપુરાથી બનાવીને લાવીશું!" કેવો ભાવ! કેટલો બધો પ્રેમ! આને કહેવાય પ્રેમનો ટાંકો! તાણીઓના ગડગાટથી આખો હોલ ગાજ ઉઠ્યો.

બળદેવભાઈએ પૂજ્યશ્રી ગુરુદેવનું કંકુચોખાથી તિલક કરીને અને કૂલોનો હાર પહેરાવીને સ્વાગત કર્યું. બળદેવભાઈના નાના ભાઈ ગોરધનભાઈએ પણ સ્વાગત કર્યું. ગુરુદેવ કહ્યું "આવા સંસ્કારી અને લોકકલ્યાણનું કામ કરનાર પુત્રોને જન્મ આપનાર માતાનું પણ આપણે સંન્માન કર્યું જોઈએ. પણ માતા તો અતિવૃદ્ધ હોવાના કારણે આવી શક્યાં ન હતાં, તેથી તેમના પ્રતિનિધિ તરીકે તેમના નાના પુત્ર શ્રી ગોરધનભાઈને શાલ ઓઢાડવામાં આવે." સૌઅે જ્ય બોલાવી.

બળદેવભાઈના પરિવારજનોએ તથા દેવચંદ્રભાઈ અને હંસાબેને પૂ. શ્રી ગુરુદેવની ઓમ્ભૂ પરમાત્માની આસ્તી ઉતારી. વલસાડ ઓમ્ભૂપરિવાર તરફક્થી શ્રી કિરણભાઈ, રશમબહેન વગેરે એ શ્રી ગુરુદેવનું સ્વાગત કર્યું.

કોઈ દોસ્ત પણ નહીં કે દુષ્મન પણ નહીં કિરણભાઈએ પૂરા કદનો મોટો તુલસીનો હાર અને માથે મુગટ પહેરાવ્યો. રશમબહેન મોટો કૂલનો હાર પહેરાવ્યો અને સ્વાગત કર્યું. શ્રી ગુરુજીએ હસતાં હસતાં કહ્યું કે તથે આવડો મોટો કૂલનો હાર પહેરાવેશો તો કિરણભાઈએ (તમારા પતિએ) પહેરાવેલો હાર હંકાઈ જશે!

શ્રી ગુરુજીએ વખતી પ્રસાદી વહેચવાનું ચાલુ કર્યું. પૂજ્યશ્રી નામ બોલે એ પ્રમાણે ડોક્ટર ભિસ્કુલ્ટ વખત ઓફાડે, કોઈને ધોતી, કોઈને કાપડ, કોઈને શાલ, તો કોઈને ઓમગુરુઓમના પીળા ખેસ. શ્રી જ્યોતિષભાઈ, શ્રી રમેશભાઈ પાઢક, રમેશભાઈ પંડ્યા, રમેશભાઈ મહેતા, સુધાકરભાઈ જાની, તુખારભાઈ પંડ્યા, ભાનુબહેન(નવસારી), રશ્મિબહેન(વલસાડ), મહીભાઈ પટેલ, મુંબઈથી શ્રી ગુણવત્તભાઈ, ઉત્તમકુમાર જોખી, મનહરભાઈ ઉપાધ્યાય, લંડનથી આવેલ અરવિંદભાઈ સોનીના દીકરા જગતભાઈ, યશવત્તભાઈ પટેલ, આધ્યાત્મભાઈ, સવિતાબહેન પ્રજાપતિ, હેમાબહેન આચાર્ય, ઉમરેઠના મધુભાઈ વગેરે.

તમને સૌને જીવનનું ભાથું મળે તે આપવા માટે અમે તમારી પાસે આવીએ છીએ-વાતો કરીએ છીએ. જીવન એવું જીવીએ કે બધાંની સાથે સદભાવ રહે - સમભાવ રહે. નીચેના દોહરામાં એ વાત સુંદર રીતે રજૂ કરી છે:-

કબીર ખડા બાજારમે સબકી પૂછે ઘૈર,  
ના કાઢુ સે દોસ્તી, ના કાઢુ સે બૈર!

**ભાવાર્થ:** બજર વચ્ચે ઉભા રહીને જતાં - આવતાં સૌ લોકોની ખબર અંતર પૂછે છે, બધાંની સાર-સંભાળ રાખે છે-પણ કોઈનીય તરફ મોહ-મમતા નહીં, વેર નહીં કે અભાવ પણ નહીં.

પૂજ્ય મોટાના એક ખૂબ જ નિકટના સાથી હતા-નંદુભાઈ તેઓ હીરા જવેરાતના ખૂબ મોટા વેપારી. શરૂઆતના વરસોમાં તેઓ જ્યારે પૂજ્ય મોટા પાસે દીક્ષા લેવા ગયા ત્યારે પૂજ્ય મોટાએ પૂછ્યું "નંદુભાઈ તમારે કોઈની સાથે અભોલા છે?" નંદુભાઈ કહે "મારે તો કોઈની સાથે વેરભાવ કે અભોલા નથી, પણ કોઈ મારી સાથે અભોલા રાખતું હોય તો એમાં મારો વાંક નથી. પૂજ્ય મોટા કહે "હું એ કંઈ ના જાણું. તમારી સાથે જેને પણ અભોલા હોય તો તે છોડાવો." નંદુભાઈએ એ પ્રમાણે કર્યું. કેટલી બધી ઊંચી સમજણ! કેવો આધ્યાત્મિક ગુણ! પછી તો તેઓ પૂજ્ય મોટાની સાથે ઘણાં વર્ષા સુધી રવા-અંતિમ ક્ષણ સુધી તેમની સેવા કરી.

હમણાં અમેરીકાથી મહેમાન આવેલા છે-વિજયભાઈ પટેલ. આવતી ગુરુપૂર્ણિમા એમના તરફથી ઊજવવાની છે. સૌએ 'સત્યધર્મગુરુદેવ કી જ્ય' બોલાવી. એમના તરફથી એટલા માટે કે એ બહાને તેઓ ઇન્ડિઝા આવે.

જેમ ગુરુપૂર્ણિમાની જાહેરાત થઈ તેમ આ વખતની

ઓમ્ભૂજયંતીની ઊજવણીની પણ જાહેરાત કરતાં પૂજ્ય શ્રી ગુરુદેવ કહ્યું કે આ વખતની ઓમ્ભૂજયંતી શ્રી હરીષભાઈ જિરિજાશંકર પ્રભાશંકર જોખી તરફથી ઊજવવામાં આવશે. સૌએ તાળીઓના ગડગડાટથી વાત વધાવી લીધી.

આપણી ગુરુપૂર્ણિમાની આમંત્રણ પત્રિકા તમે સૌએ વાંચી હશે. તેમાં ડો. ભમગરાણી "મન દુરસ્ત તો તન દુરસ્ત" લખાણવાળી એક પત્રિકા છે. તેઓ બહુ મોટા નિસર્ગોપચારક હતા. દુનિયાના મોટામોટા નિસર્ગોપચારકોમાં તેમની ગણના થતી. આપણા ખૂબ પ્રેમી હતા. અદિસાના પ્રખર હિમાયતી હતા. તેઓને આંખે મોતિયો આવ્યો. મોતિયાના ઓપરેશન વખતે આંખમાં નાખવાની જે દવા આવે તે જીવ-હિસા કરીને બનાવેલી હોય. જીવોની હિસા કરીને બનાવેલી દવા આંખમાં ન નાખવી પડે એટલા માટે તેઓએ જીવનભર મોતિયો ઉત્તરાચ્યો ન નહીં" મોતિયા વાળી આંખે જ આખી જિંદગી ચલાયું! કેવા જીવદ્યા પ્રેમી કહેવાય! થોડા સમય પહેલા તેઓ ૮૧-૮૨ વર્ષની ઉમરે દેવ થઈ ગયા. વલસાડના કિરણભાઈના પિતાશ્રી દોલતભાઈ, ખુરેશવપુરાના આપણા બે સ્નેહીજનો વિષ્ણુભાઈ અને ગોવિંદભાઈનો થોડા સમય પહેલાં સ્વર્ગવાસ થયો. આપણે, એ સે દિવંગતોને શ્રદ્ધાંજલી આપીએ. દીઘપ્રણવોચાર કરીને પછી બે મિનિટ ધ્યાન કરીએ-મૈન પાળીએ. સત્યધર્મગુરુદેવકી જ્ય.

અમે સભામાં અરધો કલાક બેસીશું-બોલીશું, એવું નક્કી કરીને ઘરેથી નીકળ્યા હતા. તો પણ બે કલાક જેટલો સમય થઈ ગયો. ઓમ્ભૂપરમાત્માની દયા અને તમારા સૈનો પ્રેમ. તુખારભાઈને કહીએ એક બે ભજન ગાય. - તુખારભાઈ એ ભજન ઉપાલ્યુ-

રામ ભજુ લે ભાઈ, હરિ ભજુ લે.....

ખબર નથી પલકી.... રે ભાઈ બાત કરે કલ ક્રી'

રમેશભાઈ પંડ્યા, મનીષભાઈ, વિરેનભાઈ, કિરણભાઈ, અને બહેનોએ સંગીતમય તાલ આપ્યો.

ધરમાં કાશી, ધરમાં મથુરા, ને ધરમાં ગોકુળિયું ધામ રે.. મારે નથી જાવુ તીરથ ધામ રે.. મારે નથી જાવુ તીરથ ધામ.

સૌ ગુરુપ્રેમી ભક્તો એ ભજનની કદીઓમાં સૂર્યપુરાયો- સાથ આપ્યો અને આખા હોલમાં આનંદ-આનંદ થઈ ગયો.

આશીર્વદનનું સમાપન કરતાં પૂજ્યશ્રીએ કહ્યું- મનુષ્યજન્મ ધારણ કરીને સાર્થક કરવાનો પ્રયત્ન ના કર્યો

તો જન્મારો એણે ગયો કહેવાય. આપણું અંતિમ લક્ષ્ય મોશ - ડેવલ્યુનું રહેલું જોઈએ. સંસારમાં રહીને આ બધું તો કરતા રહેવાનું છે. એ બધું તો હાં હાં ગલોટિયાં જેવું! અંતે તો સૌ એ અંતિમ ઘેય સુધી પહોંચવાનું છે.

પ્રલુબુભજન મે આલસી, ભોજનમે હોણિયાર,  
તુલસી એસે મનુષ્ય કો લાખવાર વિકાર.

આજના આ પ્રસંગ માટે આપણા કાર્યકર્તા બાઈઓએ અહીંયાં નીચેનો હોલ ડેટલાય મહિના પહેલાં બુકિંગ કરવ્યો હતો. કાર્યક્રમ બધો નીચેના હોલમાં કરવાનો હતો, જેથી સુગમ પડે. આવનાર ઉમરલાયક ભક્તોને પણ ઉપરના માળે ચઢવામાં અગવડ પડે છે. એ બધાં વિચાર કરીને અહીંયાં મહિનાઓ પહેલાં બુકિંગ કરાયું હતું. તો ય બે દિવસ પહેલાં કહેવામાં આવ્યું કે નીચેનો હોલ મળશે નહીં પ્રોગ્રામ ઉપરના માળે કરવો

## શ્રદ્ધાંજલી

(ટેલિફોન પર પ.પૂ.ગુરુદેવક્ષીનાં આશીર્વયન ખંડેરાવપુરા-અમદાવાદ)

સત્યધર્મગુરુદેવ કી જ્ય. સત્ય અને ધર્મ એ જ આપણા ગુરુદેવ અને એમની જ્ય તો જ આપણી જ્ય.

. ખંડેરાવપુરા બળદેવભાઈનું કુટુંબ ખૂબજ ગુરુપ્રેમી છે. તેમના ભાઈઓનાં નામ પણ એવાં, ભગવાનનાં નામો જેવાં જ. ગોવિદભાઈ, બળદેવભાઈ, ગોરથભાઈ, કનુભાઈ ને દિલિપભાઈ.

ગોવિદભાઈ ઓમ્પુરીવાસી થયા તે દુઃખની વાત છે. આપણે એ દુઃખમાંથી જલ્દી બાહાર નીકળી જવું જોઈએ કારણકે આત્મા મરતો નથી અને જન્મતો નથી. એ એક ખોળિયામાંથી નીકળી બીજા ખોળિયામાં જાય છે. અત્યારે અમારી ઉમર દિવાળી પછી બ્યાસીમું બેસશે. સ્નબરુન આવી મળી શકાય એવી શરીરની સ્થિતિ નથી. બળદેવભાઈએ ફોનની વ્યવસ્થા કરી છે તેથી વાણીથી સર્વેને મળી શકાય છે. ભગવાનની જ્યાં સુધી દયા હશે ત્યાં સુધી વાણીથી લાભ આપતા રહીશું. આપણે વ્યસનથી દૂર રહીએ અને આપણાં બાળકોને પણ દૂર રાખીએ, જેથી કરીને આપણું અને આપણા બાળકોનું આરોગ્ય સારું રહે. સેને અમારા જ્ય નારાયણ.

❖ ❖ ❖ ❖ ❖

સત્યધર્મ ગુરુદેવ કી જ્ય સત્ય અને ધર્મ એ જ આપણા ગુરુદેવ અને એમની જ્ય તો જ આપણી જ્ય.

સૌનું સ્વાગત સૌને જ્યનારાયણ. આજના પ્રસંગે આપણા લાડીલા અમારા પરમભક્ત વિઠાભાઈ તેઓને

પડશે. કેટલી બધી બેજવાબદારી કહેવાય! છેલ્લી ઘડીએ આપણા કાર્યકર્તાઓ શું કરી શકે? સત્યધર્મગુરુદેવ કી જ્ય.

બધાંએ હાથ ઊચા કરીને જ્ય બોલાવી. પૂજયશ્રી ગુરુદેવને વિદાય આપી

આ પછી ગુરુપૂજનનો કાર્યક્રમ થયો. શ્રી ગુરુદેવની ચરણપાદુકાઓનું પહેલાં મુકેશભાઈ મહારાજે પૂજન કર્ય. એ પછી એક બાજુ ભાઈઓ અને બીજી બાજુ બહનોએ લાઇનમાં આવીને સૈંચે ગુરુપૂજન કર્ય, અને બોજન-પ્રસાદ લીધો.

આનંદભર્યા વાતાવરણમાં કાર્યક્રમ સંપત્ત થયો. સત્યધર્મગુરુદેવ કી જ્ય.

સંકલન-બળદેવભાઈ પટેલ(ખંડેરાવપુરા)

શ્રદ્ધાંજલી આપી રહ્યા છીએ. અમારા પ્રેમીની પેઢીમાં જેમાં તે છેલ્લા ભક્ત. તેઓ કોઈપણ બદલાની ભાવના સિવાય નિષ્કામ લક્ત. તેઓનું લક્ષ હતું અમારી તન-મન-ધનથી સેવા કરવી. કોઈ ને પરેશાન ન કરે. તેઓ અમારી કુટીરે સેવા કરવા આવતા. વિઠાભાઈ, તેમના માતા-પિતા અને તેમનું કુટુંબ એકસરખી રીતે ગુરુનિષ્ઠ. તો જવાનું સર્વ માટે નક્કી છે. પણ કોઈ તેમની પાછળ પ્રશંસા કરે, આસુ વહાવે કે કોઈ તેમની પાછળ ટીકા કરે કે તે ખૂબ કનાડતો હતો - બસ વાત આટલી જ.

તીન ટુક કોપીનકો અરુ બિનભાળ લોન

રધુબીર ઉર બસે ઈન્દ્ર બાપડો કોણ

ગમે તેટલા પૈસાવાળા થઈએ, કારખાનાવાળા થઈએ પણ જમવામાં તો બે રોટલી, થોડા દાળ-ભાત! બાકી તો બધું બેંકમાં - જ્યાં ઈંદ્ર હીય ત્યાં આપણે એના ચોકીદાર.

ખરો બુધિશાળી કોણ? પોતાની સારી સ્થિતિ હીય ત્યારે પરબ્રહ્મનું ભાથું બાંધી લે જેથી સારા કુટુંબમાં જન્મ થાય. આગલા જન્મનું ભાથું બાંધી જવાનું છે એ કચારે બાંધી જવાય? જ્યારે તન-મનની સ્થિતિ સારી હીય. જ્યારે હાથમાંથી બધું ચાલ્યું જાય પછી શું?

આપણે ઓમ્પરિવારમાં સત્યધર્મગુરુદેવની જ્ય બોલાવીએ છીએ. સત્ય-ધર્મ એજ આપણા ગુરુદેવ - એ પછી કાંઈ બાકી ના રહે. જેમ કે રામયન્દની જ્ય,

કુષ્ણયંત્રની જ્ય, સહજાનંદની જ્ય, શ્રી શંકરની જ્ય, દેવ-દેવની જ્ય. એ બધી વાત એમાં આવી જ્ય. જેમ કે રામયંત્રની જ્ય કે સહજાનંદની જ્ય શા માટે બોલાવીએ છીએ? રાવણની જ્ય કેમ નથી બોલાવતાં? રાવણને તો દરશ માથાં હતાં, વીસ ભુજા હતી આવો બળવાન હતો તો પણ તેની જ્ય નથી બોલાવતા. કેમ કે તે અધમી હતો. જ્યારે રામયંત્રની જ્ય એટલા માટે બોલાવીએ છીએ કે તેઓએ બીજાના રક્ષણ માટે પોતાનાં સુખ ત્યજ દીધાં હતાં, સત્ય અને ધર્મ માટે જીવી ગયા હતા. એટલે સત્ય અને ધર્મમાં બધાની જ્ય આવી જ્ય સત્ય અને ધર્મની જ્ય તો જ આપણી જ્ય, તોજ આપણો મનુષ્યજીનું સફળ થાય.

શરીર ધારણ કરીએ તો ટકાવી રાખવા ભોજન કરવું પડશે. ભોજન શા માટે કરવાનું છે- ભજન માટે. બીજાં પ્રાણીઓ ગાય-બેંસ ભજન ન કરી શકે. મનુષ્ય ધારે તો ભજન કરી શકે, ન ધારે તો ન કરી શકે. મનુષ્ય શરીર ધારણ કરી ભજન ના કર્યું તો આપણે પણ શિંગડા-પુંછડા વગરના પણ જ કહેવાઈએ. મનુષ્યે ખાંધું, પીંધું અને રાજ કર્યું એની ઉપર પણ છે.

મનુષ્ય જન્મમાં પણ યાતના વેઠીને પસાર થવું પડશે, તો બીજા જન્મની વાત શુ?

પુનરપિ જનનમ્ભ પુનરપિ મરણમ્ભ  
પુનરપિ જનનિ જઠરે શયનમ્ભ

મનુષ્ય સારાં કર્મ ન કરે તો ભગવાન શું કરે? ગુરુદેવ શું કરે? તે તો આંગળી ચીંધી દે. વર્ષાથી આપણે બધું સાંભળતા આવ્યા છીએ તો તેનું પાલન કરીએ. આ બધું આપોજન એટલા માટે કર્યું છે, કે આપણો ઉત્સાહ વધારવા માટે. તો જેમ બને તેમ સંસારમાંથી વૃત્તિ પાછી જેચી લેવી જોઈએ. વધુમાં વધુ પરોપકાર કરી લેવો એવી પ્રેરણા લઈએ.

વર્ષા પહેલાંની વાત છે. વિઠલભાઈ કહે- “ગુરુજી અહીં ફાવટ આવતી નથી. આપ સ્વીકૃતિ આપો તો પાછા જાલવાડ રહેવા જતા રહીએ.” અમે કહ્યું- “જાલવાડ જવાથી અહીં કરતાં વધુ સુખી થશો તેની તમને ખાત્રી છે?” તેઓ કહે - “કાંઈ નકી નહીં.” અમે કહ્યું “તો પેઢીઓથી જ્યાં વસો છો તે છોડાય નહીં, જ્યાં છો ત્યાં જ પ્રયત્ન કરો.” ગુરુપ્રેમી વિઠલભાઈ તુરત જ માની ગયા.

શ્રી રાધવજ્ઞભાઈ, રવજ્ઞભાઈ, માધાભાઈ, લક્ષ્મણભાઈ, વિઠલભાઈ વ.સૌ અમારા ખૂબ પ્રેમી-આશાંકિત. તમે સૌ પણ ખૂબ જ ગુરુસંતપ્રેમી છો તો જ ટેલિફોન ઉપર ગુરુજી નો સંતસંગ ગોડની શકોને!

સૌને વંદન- અત્મિનંદન- આશિષ

## સફળતા

-મનિષ બી. પટેલ

“સફળતા” કોને કહી શકાય? સફળ વ્યક્તિ કોણ બની શકે! હોઈ શકે? દરેક વ્યક્તિત “સફળતા”નું અર્થઘટન પોતાની રીતે કરતો હોય છે. પૈસાદાર બનવું, સમાજમાં બધું મોટું નામ બનાવવું વગેરે જીવી ધણી સફળતાઓ દરેક વ્યક્તિતના મનમાં રમતી હોય છે. અને આ પ્રકારની સફળતા મેળવવા માટે થઈને વ્યક્તિત તન-તોડ પ્રયત્નો કરતો જ રહે છે.

આ બધી સફળતાઓ મેળવવા માટે વ્યક્તિત પાસે એક નિસરણી હોય છે, જે નાનપણથી જ ઉપયોગમાં લેવાતી હોય છે. અભ્યાસ દરમ્યાન નંબર આગળની હરોળમાં રાખવાની મહેનત, ત્યારબાદ વ્યવસાયમાં કે નોકરીમાં સહયોગીઓથી આગળ નીકળી વધુ પૈસા-નામ કમાવાની હરીઝાઈ અને પાંચું આ બધાં કામ કરાવવા માટે આપણે ભગવાનને પણ સાથે લઈએ છીએ. હે ભગવાન જો મારો પહેલો નંબર આવ્યો તો હું તમને ઓક્ટોબર-૨૦૦૮

શ્રીઝણ ચઢાવીશ, હે માતાજી મારો પગાર વધશે તો હું તમને ચૂંદી ચઢાવીશ કે પણી મારો ધંધો બહુ સારો ચાલશે તો મંદિરે દર્શન કરવા ચાલતો આવીશ. આવાં વાક્યોથી આપણે ભગવાન પાસે સફળતા માંગતા હોઈએ છીએ.

શું ખરેખર આપણે ભગવાન પાસે આવી સફળતા માંગતા હોઈએ છીએ? આવી બધી માગણીઓ, દરિયામાંથી એક લોટો પાણી ભરવા જેટલી નાની હોય છે. દરિયો તો જેટલું પાણી જોઈએ તેટલું આપવા તેયાર હોય છે, પણ આપણે તેમાંથી એક લોટો પાણી ભરીને સંતોષ માની લઈએ છીએ.

તો પછી માણસનું જીવન સફળ થયું તેવું કયારે કહી શકાય? જ્યારે આપણે આપણું જીવન શાંતિપૂર્વક અને સુખમય જીવી જોડીએ તેને જ ખરી સફળતા કહેવાય. ભગવાન પાસે માગવું જ હોય તો જીવનની આવી સાચી

સફળતા માંગીએ. આપણો તો દરિયાને એટલી પ્રાર્થના કરવાની હોય કે મને ઉપયોગી થાય એટલું પાણી આપો, એટલે આપણાને જેટલું જરૂરી હોય તેટલું પાણી આપણાને મળી જાય.

ખૂબ પૈસાદાર બનવાની લાલચમાં આપણો ઘણાંનાં દિલ દુઃખાવતા હોઈએ છીએ. માન-સન્માન મેળવવાની લાલચમાં બીજાઓનું અપમાન કરતાં વાર નથી કરતા. આવી બધી વાતોથી એવું નથી સમજવાનું કે આપણો કંઈ કરવું જ ના જોઈએ. આપણો તો જીવન-નિર્વહિ ચલાવવા કે પરિવારની જવાબદીઓ પૂરી કરવા માટે કમાવાનું તો છે જ પણ કેવળ પૈસા બનાવવાનું ધ્યેય ન રાખતાં

## નિસર્ગોપચાર ને વ્યાપક અર્થમાં સમજીએ

-યોગભિક્ષુ

વ્યાધિમુક્ત થવા માટે જે જે ઉપચારો પ્રયત્નિત છે તેમાં નિસર્ગોપચારની મહત્વાં ઘણી માનવામાં આવે છે, કેમકે તે નિસર્ગનો ઉપચાર છે. નિસર્ગ દ્વારા જ જે શરીર-ચ્યાના થઈ છે તે શરીરના ઉપચાર પણ નિસર્ગના-કુદરતના ઉપચારો દ્વારા થાય તો જ વધુ સરળતા રહે અને સફળતા મળે તે સરળતા મળે તે સરળતાથી સમજાય તેવી વાત છે.

નિસર્ગોપચારમાં પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ તથા સાત્ત્વિક આહાર-વિહાર, અંતરંગ અને બહિરંગ યૌગિક સૂક્ષ્મ વ્યાયામ વગેરેને તેનાં મુખ્ય અંગ તરીકે ગણવામાં આવે છે. છતાંય નિસર્ગોપચારના અગત્યના અને અભિજ્ઞાન અંગ સમાન નિભન્નલિખિત થોડી જાણકારી પ્રામ કરવાની ઘણી અગત્ય છે. તે રજૂ કરવાનો નમ્ર પ્રયત્ન કરીએ છે.

-: વાત્સલ્ય:-

નિસર્ગોપચારકોમાં દર્દિના ઉપચારો કરતી વખતે દર્દી તરફ ભરપૂર વાત્સલ્યભાવ- આત્મીયભાવ હોવો અત્યંત જરૂરી છે. નિસર્ગોપચારકનો, દર્દી તરફ વાત્સલ્યભાવ એ નિસર્ગોપચારનું અતિ અગત્યનું અંગ છે. કારણકે મોટા ભાગનાં દર્દી વાત્સલ્યના અભાવના કારણે થયેલાં હોય છે. મનુષ્યના જીવનમાં બધાં જ સુખસગવડ હીવા છતાંય વાત્સલ્યનો અભાવ હોય છે અને તેથી તે જાણેઅજાણે સૂક્ષ્મ રીતે અસંતોષથી પીડાતો હોય છે. પતંજલિ મુનિએ કહ્યું છે કે સંતોષાત અનુત્તમ સુખલાભ: અર્થાત્ સંતોષથી સર્વોત્તમ સુખનો લાભ પ્રામ કરી શકાય છે. મનુષ્ય વાત્સલ્યના અભાવે લીતરમાં સતત રિબાતો જ હોય છે. આવી સતત ઓક્ટોબર-૨૦૦૮

સારી રીતે જીવન જીવાને, બીજાને પણ સાથે લઈને આગળ વધવાનું છે.

થોડા સમય પહેલાં સાભળ્યું હતું કે હુનિયાની સૌથી ધનાઢ્ય વ્યક્તિને પોતાની બધી મિલકત દાન કરીને લોકસેવામાં જીવન વ્યતિત કરવા માંડયું આ બનાવ આપણાને શું સમજાવે છે? ખૂબ ધન અને માન કમાયા પછી પણ છેવટે તો મનને શાંતિ મળે તેવા જીવવની લોકો આશા રાખે છે. તો પછી શું આપણે મનને શાંતિ મળે તે રીતે ધન અને માન ના કમાઈ શકીએ? જરૂર કમાઈ શકીએ. મનુષ્યજીવન મળ્યું છે તો તેને સાર્થક કરી જાડીએ.

રિબામણી તેના લોખંડી શરીરને ભંયકર રોગોમાં પકડી પડે છે. અને છતાં કોઈનેય ખબર પડતી નથી કે તે ભાઈ શાના કારણે રોગોમાં પટકાયા છે અને તેથી રોગમુક્ત થવા માટે અનેક પથીઓના ચક્કરમાં ગોથાં ખાવાની શરૂઆત થાય છે. પણ તોય રોગ મયક આપતો નથી. કયાંથી મયક આપે? તેને તો વાત્સલ્યપથીની-વાત્સલ્ય ઉપચારની જરૂરત છે. દરેક પથીના ઉપચારકે દર્દીને વાત્સલ્ય આપવું જ જોઈએ. પરંતુ નિસર્ગોપચારકે તો દર્દીને વાત્સલ્ય આપવાથી ચુકાય જ નહીં. જેમ દર્દીને અન્ય ઉપચારો આપવા માટે થોડો સમય ફાળવેલો હોય છે તેમ વાત્સલ્ય આપવા માટે પણ થોડો સમય ફાળવવો અત્યંત જરૂરી છે. નિશ્ચિત સમયે દર્દી સાથે બેસીને તેની જોડે મમતા અને સહાનુભૂતિપૂર્વક તેનાં સુખ-હુંબ વગેરેની વાતો ચર્ચા જોઈએ. આમ વાત્સલ્યભાવમાં દર્દીને તરબોણ કરી દેવો એ પણ નિસર્ગોપચારનું એક અગત્યનું અને નિષ્ઠળ ન જનારું અંગ છે. વાત્સલ્ય એ તો તંહુરસ્તી પ્રામ કરવા માટે નિસર્ગ આપેલી અતિ પવિત્ર બાંધિશ છે. હવે બીજા અંગને પણ જાણીએ.

-: કુદરતનો આદેશ:-

એક દાદા અમ્ને મળવા આવ્યા અને પૂછવા લાગ્યા કે “મારો જઠારાજિન મંદ પડી ગયો છે તેથી પહેલા કરતાં અડખો જ ખોરાક લઈ શકાય છે.” અમે કહ્યું કે તો તમે અડખો જ ખોરાક લ્યો. તો તેઓ કહે કે “તો ખૂબ અશક્તિત આવી જાય છે.” અમે કહ્યું કે તો તમે જેટલી શક્તિ હોય તેટલી પ્રવૃત્તિ કરો.

વૃધ્ઘાવસ્થામાં જેમ આંખ, કાન, દાથ, પગ વગેરે શિથિલ થાય છે તેમ જઠારાજિન પણ મંદ પડે છે. આ

બધુ કુદરતી જ છે. આવા વખતે પણ તેટલું જ ભોજન કરીને કુદરતના આદેશને સહર્ષ માથે ચઢાવી લેવો તે પણ કુદરતી ઉપયાર જ છે. અને તેમ કરતાં જો અશક્તિ આવે તો શક્તિ મુજબ જ પ્રવૃત્તિ કરવી જોઈએ. સંસાર - વ્યવહારની પ્રવૃત્તિઓને ધીરેધીરે સંકેતાત્ત્વ જવ એમ કુદરત કહી રહી છે. કુદરતના આવા અમગટ ઈશારાને સમજું જરૂરીને તેનો અમલ કરવા લાગી જવું જોઈએ. જો કુદરતના આવા ઈશારાને નથી સમજતા કે સમજ્યા છતાં પણ સ્વેચ્છાએ તેનો અમલ નથી કરતા તો કુદરત જબરજસ્તી પોતાના આદેશનું પાલન કરવશે જ. હસતાં હસતાં કુદરતના આદેશનું પાલન કરવામાં અલોકિક આનંદ અને સંતોષની પ્રાપ્તિ થાય છે. આવી સમજણનું હોવું એ પણ નિસર્ગોપયારનું એક અંગ જ છે. નિસર્ગોપયારમાં માનવવાળાઓએ અને તેના ઉપયારકોએ નિસર્ગોપયારને ખૂબ વ્યાપક અર્થમાં સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણા મનની સંકીર્ણતાના કારણે આપણે નિસર્ગને પણ સંકીર્ણ ન સમજ લેવી જોઈએ. તેને એકાંગી બીબામાં ન ઢાળવી જોઈએ. આવી વ્યાપક સમજણનું હોવું એ પણ નિસર્ગોપયારનો એક અગત્યનો ભાગ છે. હવે ત્રીજા અંગની વાત કરીએ.

### - ગુરુપથી :-

“મનુષ્યરૂપ યત્ન અર્ન ઈશ્વરરૂપા.” મનુષ્યે યથાશક્ત પુરુષાર્થ- પ્રયત્ન પૂર્ણ સાવધાનીથી કરવો જ જોઈએ. સ્વાસ્થ્ય પ્રામ કરવા માટે શક્ત તેટલી બધી જ પથીઓને અજમાવી જ જોઈએ. કારણકે કઈ પથી કયારે, કોને અને કેવી રીતે કારગત નીવડશે તેની કોઈનેય ખબર નથી. દરેક પથીના સંશોધકોએ એડિચોટીનો પરસીનો એક કરીને પોતાની પથીની શોધ કરવાના પ્રયત્નો કર્યા હોય છે. “સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ, માનવ માત્ર અધૂરા” અપૂર્ણ માનવ દ્વારા શોધાયેલી પથી પૂર્ણ હોય જ કર્યાંથી? અધૂરી જ હોય. “અમારી જ પથી સાચી અને બીજાની ખોટી” એમ માનનારાઓ અને કહેનારાઓ પોતાની અજ્ઞાનતાનું જ પ્રદર્શન કરતા હોય છે. માટે સ્વાસ્થ્ય પ્રામ કરવા માટે શક્ત તેટલી બધી જ પથીઓને-પદ્ધતિઓને- સારવારોને અજમાવવી જ જોઈએ.

પણ જ્યારે બધી જ પદ્ધતિઓ નિષ્ફળ જાય ત્યારે શુ કરવું? ત્યારે કઈ પથીનો આશરો લેવો? ત્યારે કઈ

પદ્ધતિના શરણે જવું? ત્યારે-

મનુષ્યે ગુરુપથીના શરણે જવું જોઈએ. પણ ગુરુપથીએ શું છે? ગુરુજનો આપણા માથે હાથ મૂકી આશીર્વાદ આપી દે કે “જી બેટા સાજો થઈ જઈશ” માત્ર એ શું ગુરુપથી છે? ના, ના. ગુરુપથી એટલે ગુરુજનો દ્વારા પ્રામ થયેલી સાચી સમજણના શરણે જવું, તેમના દ્વારા મળેલા નિર્બન્મ જ્ઞાનનો આશરો લેવો, તેમના દ્વારા સાંભળેલા ઉપદેશ પ્રમાણે કોઈપણ પરિસ્થિતિ સામે જ્ઞામવા તેથાર રહેવું.

ગુરુજનો દ્વારા આપણને અનેક વખત સાંભળવા મળે છે કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. બ્રહ્મ જ એક સત્ય છે, નિત્ય છે, જગત બધું મિથ્યા છે અર્થાત્ નાશવંત છે. જગતમાં શરીરનો પણ સંમાનેશ થઈ જાય છે. તેથી શરીર પણ મિથ્યા છે-નાશવંત છે. પંચમલાભૂતથી બનેલા શરીરનો કુદરતી કમ જ છે- બચપણ, જીવાની, બુઢાપો, જન્મ અને મૃત્યુ. કહેવાતા ભગવાનના અવતારો મોટા મોટા યોગીજનો, ચક્કવર્તી, બૂપતિઓ, વગેરે સૌના શરીરોનો નાશ થઈ ગયો. પણ, પક્ષી કે મનુષ્ય સૌ કાઈ, કે જેના શરીરો મહાપંચભૂતનાં છે તેમનો સૌનો નાશ થઈ ગયો. આ પ્રમાણે થવું એ કુદરતનો અટલ કમ જ છે, શરીરનો એ ધર્મ જ છે, નિસર્ગનો એ અફર નિયમ જ છે. ઉપરોક્ત નિસર્ગના અફર નિયમની સમજણની કદી વિસ્મૃતિ ન થવા દેવી તે ગુરુપથી છે. આપણા રોગ માટે બધી પથીઓ જ્યારે નિષ્ફળ જાય ત્યારે હિમત દ્વારી ન જવી, ઉત્સાહભંગ ન થઈ જવું, વિવેક વીસરી જરૂરી જરૂરે જ્યાં ત્યાં વલખાં ન પારવા, ખોટા વહેમોના ચક્કરમાં ન ચડી જવું એનું નામ ગુરુપથી. “કુદરતી કમ પ્રમાણે જે થવાનું તે જ થશે” એ માન્યતામાં દઢ રહીને જે પરિસ્થિતિ આવી પડે તેના સામે ટકકર લેવા તેથાર રહેવું. “આખં જાન્છવી તોંય, વૈઘો નારાયણો હરિ” અર્થાત્ “ગંગાજળ એ મારું ઔષધ છે અને પરમાત્મા મારા વેદ્ય છે” એવા સંકલ્પમાં દઢ થઈ જવું, કુદરતી કમને વશ થઈ જવું, તે વખતે જ કાંઈ કષ્ટો ભોગવાં પડે તેને તથ સમજણે સહર્ષ સહન કરવાં તે ગુરુપથી છે. ગુરુપથી એ નિસર્ગોપયારનું અવિભાજ્ય અંગ છે. ગંગાપથી સિવાયની બીજી બધી જ પથીઓ લઘુપથીઓ છે. કારણ કે જ્યાં બધી પથીઓ નિષ્ફળ જાય છે ત્યાં એક ગુરુપથી જ શરણું આપે છે. તેથી જ તે ગુરુપથી છે. અર્થાત્ અતિ મહત્વની કુદરતી પદ્ધતિ છે.- અસ્તુ.

## મન દુરસ્ત તો તન દુરસ્ત - ધ્યાન

આજના માનવીની આધિ, વ્યાધિ અને ઉપાધિઓ માટે દવા કે ડોક્ટરી ઉપચારો કરતાં ધ્યાનની આવશ્યકતા વધુ છે.

ધ્યાન એટલે કોઈપણ વિચારના વંટોળ કે વમળ વિનાની શુદ્ધ જાગૃત અવસ્થા. વિચાર હમેશાં ગતિમાન હોય છે. એ ગતિમાન ન હોય તો વિચાર જીવંત રહી શકતો નથી. માનસિક સ્વચ્છતા અને સ્વસ્થતા માટે મનમૌનનો અભ્યાસ જરૂરી છે. ઉંઘ આપણને અંશતઃ શારીરિક આરામ આપી શકે છે, પરંતુ માનસિક આરામ તો જવલ્લે જ - ઉંઘમાં પણ જવલ્લે જ - મળે છે. માનસિક આરામ ધ્યાન વિના અસંભવ છે.

જેમ આપણા ખોરાકનો ધૂષો બધો ભાગ શરીરને બિનજરૂરી હોય છે, તે જ પ્રમાણે મનને પોષણ આપવા માટે પણ બહુ ઓછા વિચારની જરૂર છે. વળી, જેમ એક ભોજન અને બીજા ભોજન વચ્ચે અંતર જરૂરી છે, તેમ એક વિચાર અને બીજા વિચાર વચ્ચે અવકાશની જરૂર હોય છે. જેમ મોટેભાગે આપણો શારીરિક ખોરાક ખોટા પ્રકારનો હોય છે. તેમ આપણો માનસિક ખોરાક પણ ખામી ભર્યો યા નુકસાનકારક હોય છે. જેમ અયોગ્ય અને અતિ આહારને કારણે કલ્પિયાતથી આપણો પીડાઈએ, તે જ પ્રમાણે કુવિચાર અને અતિ-વિચારથી

આપણે માનસિક કલ્પિયાતથી રહી, વ્યારે કે ઉગ્ર સ્વભાવથી પીડાઈએ છીએ. જેમ આપણને ખોટાં ખાનપાનની સહેલાઈથી આદત પરી જાય છે, અને પછી તેને જ આપણો સાચો આહાર માનવા લાગીએ છીએ, તદનુસાર ખોટા નકામા વિચારોને આપણે સાચા માનવા લાગીએ છીએ. જેમ આપણે આંતરડાંમાં પુષ્ટણ કર્યારો લઈને ચાલતી ફરતી કચરા-પેટી જેવા બની ગયા છીએ તે જ પ્રમાણે આપણે આપણા માસ્ટિઝમાં પણ પારાવાર કચરો સંધરીને આપણે માનસિક દબાણ અને તાણના બોગ બનીએ છીએ.

કચરો આંતરડાનો હોય કે મસ્સિઝનો, આપણે અને સહેલાઈથી છોડતા નથી. શારીરિક ઉપવાસની આપણને રોજિંદી આવશ્યકતા છે. રોજ બાર કલાક ઉપરાંત આપણે કોઈપણ ખોરાક ન લેવો જોઈએ. એ જ રીતે રોજ થોડી મિનિટોનો માનસિક ઉપવાસ પણ કરવો જોઈએ. માનસિક ઉપવાસ એટલે ધ્યાન.

ધ્યાનથી આપણે આપણા મૂળ સ્વભાવ તરફ વળીએ છીએ. એ મૂળ સ્વભાવમાં જ શાંતિ હોય છે, ઉલ્કાપાત નહીં. એ સ્વભાવ નિસર્ગદા છે, સહજ છે. ધ્યાનથી જ આપણે સ્વાસ્થ્યમાં પોતાને સ્થાપિત કરી શકીએ છીએ; એ માટે બીજો કોઈ ઈલાજ છે જ નહીં.

ડૉ. ભમગરા, લોનાવાલા

## ૪. પુ. ગુરુદેવ શ્રી યોગભિકુજીના સત્સંગમાંથી સાભાર

❖ જ્ઞાન, યોગ અને ભક્તિ કોને કહેવાય? ❖

ચિત્તવૃત્તિઓનો નિરોધ કરી રીતે કરવો તેની પૂર્ણ જ્ઞાણકારી પ્રામ કરવી તે ‘જ્ઞાન’, તે જ્ઞાણકારી - તે જ્ઞાન પ્રમાણે આચરણ-કિયા કરીને ચિત્તવૃત્તિનિરોધરૂપી ફળ પ્રાપ કરી લેવું તે ‘યોગ’ અને ચિત્તવૃત્તિનિરોધ - સુખમાં પ્રેમ થઈ જવો તે થઈ ‘ભક્તિ’.

જેમકે, લાદુ કરી રીતે બનાવવા તેની જ્ઞાણકારી પ્રામ કરવી તે થયું (લાદુ બનાવવાનું) “જ્ઞાન”. જ્ઞાન પ્રમાણે લાદુ બનાવીને જમીને તૃત્મ થવું તે ‘યોગ’ અને પછી એ લાદુમાં પ્રેમ થઈ જવાથી, લાદુભક્ત થઈ જવું તે થઈ ભક્તિ.

❖ લાદુ દુઃખોકી એક દવા ❖

એક ઉપવાસ અનેક રોગને હણે. કેમકે મોટા

જ્ઞાનના રોગો અન્તિ પોષણના કારણે જ થતા હોય છે. જિલ્લાદીન્દ્રિય અને જનનઈન્દ્રિય મનુષ્યજીવનમાં અતિ મહત્વનો ભાગ ભજવે છે. તે બને ઉપર જેટલો સંયમ વધારે તેટલી આરોગ્ય-પ્રાપ્તિ વધારે. કસ્તૂરી મૃગની નાભિમાં જ છે પણ તે તેને બહાર ગોતે છે. તેમ મનુષ્ય પણ પોતાની જ નાભિમાં અને જીભમાં રહેલી આરોગ્ય રૂપીકસ્તૂરી માટે બાહર ફાંઝા મારે છે કે જે “લાદુઃખોકી એક દવા” જેવી છે.

મનમાં જ્યારે એમ થાય કે ‘ખાઉ કે ન ખાઉ’ ત્યારે ન ખાવાના જ નિર્ણય પર આવવું અને જ્યારે એમ થાય કે જાજરુ જરૂ કે ન જરૂ તારે જાજરુ જવાના જ નિર્ણય પર આવવું. આથી પણ આરોગ્યરક્ષામાં ખુલ સહાય મળશે.

## ❖ કર્મનો અટલ નિયમ ❖

મનુષ્યમાત્ર સુખને - દીર્ઘ સુખને ઈચ્�ે છે. પણ કેવી રીતે તે પ્રાપ્ત થશે તેની તેને ખબર નથી. "સારાં કર્મથી સુખી થવાય અને ખરાબ કર્મથી દુઃખી થવાય" એ કર્મના અટલ નિયમ ને જ્યાં સુધી મનુષ્ય માનતો નથી ત્યાં સુધી તે તેનું પાલન કરતો નથી અને જ્યાં સુધી તેનું પાલન કરતો નથી ત્યાં સુધી તે સુખી થઈ શકતો નથી. સત્તકર્મો કરવાથી પુષ્ય થાય છે અને પુષ્યથી સુખી થવાય છે; અસત્તકર્મો કરવાથી પાપ લાગે છે અને પાપથી દુઃખી થવાય છે એમ શાસ્ત્રો સમજાવે છે. સ્વર્ગ અને નર્ક એ પણ સુખ અને દુઃખના જ પર્યાયવાદી શહેરો છે. અતિ સૂક્ષ્મ વિષયોને પણ સરળતાથી સમજી શકાય તે માટે શાસ્ત્રો અને આમજનો અનેક યુક્તિપ્રયુક્તિઓનો પ્રયોગ કરે છે. કર્મના અટલ નિયમને અતિ સરળતાથી નીચે મુજબ સમજાવે:-

## પ.પૂ. ગુરુદેવશ્રી યોગભિક્ષુજી રચિત ગુરુ મહિમામાંથી સાભાર

- સંકલન: સ.સ.ભિક્ષુ

### - ગુરુ પ્રેમ-સમર્પણ-ધ્યાન :-

પરમાત્મા વિષેનું જ્ઞાન કાંઈ એક દિવસમાં આપી શકતું નથી. આ બધી વાતો મહાપુરુષો અને ગુરુજનો સારી રીત જાણે છે. તેથી આપણો પ્રકૃતિ, સ્વભાવ, સ્થિતિ વગરેને ધ્યાનમાં રાખી, ગુરુજનો, ગુરુજ્ઞાન આપવાનો પ્રયત્ન કરતા હોય છે. એમાં વર્ષા પણ વહી જ્યાં છે. આપણને એ ખબર પણ નથી રહેતી કે ક્યારે એમણે કયું જ્ઞાન આપણને આપી દીધું. ચાહે એમની ઉપસ્થિતિમાં, કે ચાહે એમની ગેરહાજરીમાં; સૂક્ષ્મરૂપે આપણને એમના તરફથી જ્ઞાન મળતું જ રહે છે. જ્યાં સુધી આપણો એમના તરફ પ્રેમ છે ત્યાં સુખી એમનું જ્ઞાન આપણે ખેંચી શકીએ છીએ, અહંકાર કરી શકીએ છીએ. એ પ્રેમનો સૂક્ષ્મ તાર ગુરુજનો સાથેનું આપણું અનુસંધાન છે.

(ગુ.મ.પા. નં. ૮)

### ❖ ❖ ❖ ❖ ❖

જે પ્રેમરૂપી તારના માધ્યમ દ્વારા આપણે તેમની પાસેથી જ્ઞાન-દ્વારા મેળવ્યું તે તારને એમની સાથે સંદર્ભ અનુસંધાનિત રાખીએ, તો જ્યારે જ્યારે ગુરુજનોને આપડી યાદ આવશે, જ્યારે જ્યારે તેઓને જ્ઞાનની સ્કુરક્ષા થશે ત્યારે ત્યારે એ અનહદ પ્રેમના સુક્ષ્મતાર દ્વારા, સુક્ષ્મ વાણી (એમનામાંથી) આપણામાં ઠલવાશે. જ્યારે ગુરુજનોને જ્ઞાનની સ્કુરક્ષા થાય, એ સમયે

ઓક્ટોબર-૨૦૦૮

પોતાની પાચન-શક્તિનો જ્યાલ ન રાખીને સ્વાદવશ અતિ ભોજન કરી લઈએ અને પેટમાં દુઃખવા આવે તો તેનું સાચું પ્રાયશ્ચિત્ત એક-એકતાણું અથવા એક ઉપવાસ છે. વધુ ભોજન કરવાથી જો પેટમાં દુઃખવા આવે તેનો સાચો ઉપાય દવા નથી, ઉપવાસ રૂપી સાચો ઉપાય કરવાને બદલે જો દવા ખાઈને પેટપીડ મટાડીશું તો ફરીફરીને વધુ ભોજન કરવાનું પાપ કરતા જ રહીશું અને એ રીતે લાંબા સમયે અસાધ્ય રોગમાં ફસાઈ જઈશું. અપરાધ મુજબનું પ્રાયશ્ચિત્ત હોય તો જ દીર્ઘ લાભ પ્રાપ્ત કરી શકાય. એક વખત દવાથી સાજી થઈશું એટલે પણી અતિ ભોજનથી દુઃખી થવાનો ડર નહીં રહે. 'પેટમાં તો દુઃખો તો દવા છે જ ને' એમ માની સતત પેટ પર અત્યારા કરતા જ રહીશું અને અસાધ્ય રોગમાં પહોંચી જઈશું.

એમના શિષ્યો સ્થૂલ સ્વરૂપે ભલે ગમે તે સ્થળે હોય, તો પણ ગુરુજનોને થયેલી સ્કુરક્ષાનો જ્યાલ શિષ્યને આવી જ જ્યાં છે. એ વખતે ગુરુજનો દ્વારા આવતી એ જ્ઞાનગંગા શિષ્યના અંતરતમમાં જિલાય છે.

(ગુ.મ.પા.નં. ૧૦)

### - અનુશાસન :-

યોગશાસ્ત્રમાં જ્ઞાનાબ્યા મુજબ બ્રહ્મરંધમાં કાળની પહોંચ નથી. કાળ શરીરના કોઈપણ ભાગમાંથી પ્રાણનું હરકા કરી શકે છે. પરંતુ પ્રાણને જો બ્રહ્મરંધમાં ચઢાવી દેવામાં આવ્યો હોય તો ત્યાં કાળની પહોંચ નથી. હર કોઈ વ્યક્તિ માટે મૃત્યુનો સમય નિશ્ચિત હોય છે, એ સમયે કાળ શરીરમાં દાખલ થઈ પ્રાણને લઈને બહાર નીકળી જાય છે. એના આગમનનો સમય નિશ્ચિત હોય છે. કાળ એ સમયમાં રહીને જ પ્રાણને હડય કરી શકે છે. એ સમય વીતી ગયા તાઈ કાળને શરીરમાં રહેવાનો હુકમ નથી. કાળ પણ નિયતિની આજ્ઞાનું પાલન કરે છે; પરમાત્માની આજ્ઞામાં, ગુરુની આજ્ઞામાં, નીતિ-નિયમોની આજ્ઞામાં રહે છે. એ કાળ કે જે જગતના તમામ જીવોના પ્રાણનું હરકા કરતો રહે છે, તે પણ પરમતત્વના અનુશાસનમાં રહે છે તો આપણે તો કેટલા અનુશાસનમાં રહેવું જોઈએ?

(ગુ.મ.પા. નં. ૨૬)

# પરમાત્માની અહેતુકી કૃપા

સંકલન: પ્રવીણભાઈ શાહ

આપણાં નીમુખલેન હમણાં નિસર્ગોપચાર કેન્દ્રમાં સારવાર લેવા માટે ગયાં હતાં. અગાઉ પણ જરૂર આવ્યાં હતાં. કુદરતી ઉપચાર કેન્દ્ર એટલે શરીરશુદ્ધિનું મહત્વ વધારે. જરૂરત પ્રમાણે દર્દીને “વરાળ-સ્નાન” (સ્લીમ-બાથ) પણ આપે. વરાળ-સ્નાનથી શરીરે ખૂબ પરસેવો વળે, પરસેવે રેબજેબ થઈ જવાય. અને એનાથી શરીરમાંથી વિષદ્વયો-વિજાતીય દ્વયો બહાર નીકળી જાય, નાડીઓની શુદ્ધિ થાય, ચામડીના છિંડો ખૂલે.

પરસેવો નીકળવાથી શરીરની અંદર જમા થયેલો કચરો - અશુદ્ધિઓ બહાર નીકળી જાય. એક વખતના છૂટક વરાળ સ્નાનના લગભગ રૂ.૭૫૦/- ભરવા પડે. સામાન્ય માણસને વરાળ સ્નાન સારવાર લેવાનું પસ્યાં નહીં.

પરમકૃપાણું પરમાત્મારાએ ઋતુચકની ગોઠવણી કેટલી અનુપમ કરી છે-શિયાળો, ઉનાળો અને ચોમાસુ. શિયાળામાં ઠંડી પડે, ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ પડે. ઉનાળામાં જે સખત ગરમી પડે તેના થકી પરસેવો થાય અને આખા વર્ષ દરમ્યાન શરીરમાં જે વિષદ્વયો ભેગાં થયાં હોય તે પરસેવા વાટે બહાર નીકળી જાય. શરીરની શુદ્ધિ કુદરતી રીતે જ થાય. એક પૈસાનો ય ખર્ચ નહીં

દર વરસે ઉનાળો આવે અને આખા વરસ દરમ્યાન શરીરમાં જે વિષદ્વયો જમા થયાં હોય તે ઉનાળામાં

ગરમી પડે એટલે પરસેવા વાટે બહાર નીકળી જાય-શરીરની શુદ્ધિ થાય અને માણસ આખું વરસ નીરોગી રહી શકે. પરમાત્મા કેવા કલણાના કરનાર છે! દયાના સાગર છે! ગરીબ હોય કે તવંગર સૌની એકસરખી સંભાળ લે છે. પરમકૃપાણું પરમાત્માએ માણસજાત પર કેવી દયા કરી છે! આને કહેવાય પરમાત્માની અહેતુકી કૃપા.

પરંતુ માણસે પોતાની બુધ્ય વાપરી, એણો પંખા, એરકુલર, એરકિડિશનની શોથ કરી. શરીરને ગરમી ના લાગે એટલા માટે આ બધાં સાધનો વાપરવાનું ચાલુ કર્યું. જે શરીર પરસેવો વળવા જ ન હે! પરિણામે શરીરની અંદરના વિષદ્વયો, વિજાતીયદ્વયો, બિનજરૂરી તત્ત્વો શરીરમાંથી બહાર નીકળે નહીં જે શરીરમાં એકઠાં થયા કરે અને જલે દહાડે રોગનું સ્વરૂપ પકડે.

પ્રકૃતિને અનુકૂળ થઈને રહીએ અને આરોગ્ય સચચાવાય એ રીતની રહેણી-કરણી ગોઠવવાનો પ્રયત્ન કરીએ, પરમાત્માની અહેતુકી કૃપાનો અમૂલ્ય લાભ લેવો તે આપણા હાથની વાત છે.

દુકાનમાં વેરાયેલા લેજસેણિયા અનાજમાંથી વેંસ રાંધવી કે કુશળતાપૂર્વક તેમાંથી બાતભાતની વાનગીઓ બનાવવી તેના માટે સૌંસ્કૃતિક સ્વતંત્ર છે.

(પૂજયશ્રી ગરુદેવના-સ્વાધ્યાય સત્સંગમાંથી સાભાર  
તા. ૧૦.૦૭.૦૬)

## ટેલીઝોન પર પ.પુ. શ્રી ગુરુદેવનાં આશીર્વચન

તાલીમકેન્દ્ર - મણીનગર

સંગ્રહક: પ્રવીણભાઈ શાહ

●તા.૨૬.૭.૦૮ રવિવાર●

સૌને જયનારાયણ! કેટલાં માણસો આવેલાં છે? સત્યધર્મગુરુદેવકી જય. આજે રવિવાર. આવતીકાલે શ્રાવણમહિનાનો પહેલો સોમવાર. થોડા દિવસ પહેલાં ગુરુપૂર્ણિમાનો મહોત્સવ સરસ રીતે ઊજવાઈ ગયો. ડેક્કટર ભિસ્કુ ખૂબ આનંદમાં હતા. બકતોને પણ આનંદ આનંદ થઈ ગયો હતો. તમે સૌએ તે દિવસે ગુરુપૂર્જન કર્યું. ગુરુપૂર્જન એ તો એક સ્થળ કિયા છે. ગુરુપૂર્જન ખરા મનથી થવું જોઈએ - આંતરિક પૂર્જન-તન-મન-ધનથી ગુરુને સમર્પિત થઈ જઈએ તે ખરું ગુરુપૂર્જન કહેવાય. તે દિવસ આપણે કબીરજીનો એક દોહરો બોલ્યા હતા. બીજી ઘણી વાતો કરવાની હતી, એટલે એના પર બહુ બોલી

ઓકોબર-૨૦૦૮

શકાયું ન હતું. આજે થોડું વિસ્તારથી સમજીએ.

‘કબીર ખડા બાજારમે, સબકી પૂછે બેર,  
ના કાઢૂસે દોસ્તી, ના કોણૂસે બેર’

મનુષ્યજન્મકિર્દી રીતે સકળ થાય? જીવનમાં કઈ રીતે જીવાનું છે? કબીર ખડા બાજાર મે-કબીરજી બજારમાં ઊભા રહીને બધાંની ખબર - અંતર પૂછે છે. બજારમાં કેટલી ચહેલ-પહેલ હોય, કેટલી બધી અવર-જવર હોય, ધરમાં બારણાં બંધ કરીને બેસી જવાનું નથી. આશ્રમ કે માદિરમાં જઈને બેસી જવાનું નથી કે ક્યાંય ભાગી જવાનું પણ નથી. બધાંની વચ્ચે - સગા - સ્નેહી - સ્વજનોની સાચે રહેવાનું છે. બધાંની કુશળતા - સાર સંભાળનો ખ્યાલ રાખવાનો છે. બધાંના સંપર્કમાં રહેવાનું છે, પણ કઈ

રીતે? જળકમળવત્ત! કમળ પાણીમાં રહીને પણ ભીજતું નથી. ના કાઢૂ સે દીસ્તી, ના કાઢૂસે બેર! કોઈનાયમાં મોહ-મમતા નહીં, દેખભાવ કે વેરભાવ પણ નહીં. જીવન એવી રીતે જીવીએ કે સંસારમાં રહીને પણ સંસારથી અણગા રહી શકીએ. કોઈ દોસ્ત પણ નહીં કે દુષ્મન પણ નહીં.

ગુરુપૂર્ણિમાની ઉજવણીના સારરૂપ આ વાત આપણે કહી હતી અને એનું નામ જ “યોગ: કર્મષુ ડેશલમ્”

તમે સૌ આ વાતને બરાબર યાદ રાખજો. ભગવાનની- માતા-પિતાની આપણા પર દયા છે. સત્યધર્મગુરુદેવ કી જ્ય.

### ●તા. ૨૭.૭.૦૮ સોમવાર●

હેલો..... બરાબર સંભળાય છે? સર્વેનું સ્વાગત, સૌને શુભેચ્છા. તમે સૌ આજે શ્રાવણ મહિના નિમિત્તે બેળાં થયાં છો. આજે પહેલો સોમવાર. આપણા ઋષિ-મુનિઓએ કેવી સરસ ગોઢવણી કરી છે? શ્રાવણ મહિનો એટલે શ્રવણ કરવાનો મહિનો. આખો મહિનો ખૂબ ખૂબ સાંઘવણાનું, શ્રવણ કરવાનું, જીવનમાં ઉપયોગી થઈ પડે એવી વાતો સાંભળવાની, તેમાંથી સાર ગ્રહણ કરવાનો, પ્રત-ઉપવાસ યથાશક્તિ રાખીને તંદુરસ્તી જળવાઈ રહે એવા પ્રયત્નો કરવાના, જેથી કરીને સ્વર્ગનું સુખ મળે, મન અને શરીરની તંદુરસ્તી જળવાઈ રહે એ જ સ્વર્ગનું સુખ. આખો શ્રાવણ મહિનો જે કંઈ સાંભળ્યું હોય તેને બાકીના અગિયાર મહિના વાગોળવાનું, તેના પર ચિંતન-મનન કરવાનું, સાંભળેલું જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનો.

ટી.વી. પર હમણાં એક સંતની વાત આવે છે. એ સંત પોતે એક ડેક્ટર છે. તેઓ કહે છે કે - મારા ગુરુએ મને એક બીજમંત્ર આપ્યો છે. આ બીજમંત્રની મદદથી ઘણા બધા રોગો મટે છે. મેં અસંખ્ય લોકોના જીતજીતના રોગો આ બીજમંત્રથી મટકાયા છે. ખૂબ સારી સફળતા મળી છે. પણ, મારા ગુરુજી કે જેમણે મને આ બીજમંત્ર આપ્યો હતો, તેઓ કહે છે કે - “અનું બને જ નહીં, આ બીજમંત્રના મેં એકાંતમાં બાર વર્ષ સુધી જીપ કરીને મંત્ર સિદ્ધ કરવાનો પ્રયત્ન કરી જોયો છે. પણ મને કોઈ સિદ્ધ કે સફળતા મળી જ નથી. એટલે એ બધું ખોટું છે. તમારી વાત હું માનું જ નહીં”!

પેલા ડેક્ટર સંત કહે કે - આ બીજમંત્ર મારા ગુરુને

એમના પિતાજી તરફથી મળ્યો હતો. એમણે, એ મંત્ર આપનાર એમના પિતાજીમાં, માત્ર પિતા તરીકેનો જ ભાવ રાખ્યો. ગુરુ તરીકેનો ભાવ સેવ્યો જ નહિં. એમના પિતાજીમાં એમને ગુરુભાવ થયો જ નહીં, એટલે તેઓ નિષ્ઠળ રહ્યા. ગુરુ બનાવ્યા પણી એકદમ સંપૂર્ણ શરણાગત થઈ જવું પડે, ગુરુમાં અનન્ય ભાવ રાખવો પડે. ગુરુ કહે તેમ કરવાનું ગુરુ કરે તેમ નહીં કરવાનું.

એક વખત પાર્વતીજીએ તેમના પતિ ભગવાન શંકરને કહ્યું કે નાથ! મને દીક્ષા આપો. મને ગુરુજીના આપો. ભગવાન શિવજી પ્રસન્ન થયા. અત્યાર સુધી પાર્વતીજીએ પત્ની તરીકે સાથે રહીને પત્નીધર્મ નિભાવ્યો હતો. હવે તેમણે શિવજીને ગુરુ તરીકે સ્વીકાર્ય- ગુરુ તરીકે સ્થાયા. અધ્યાત્મ જગતમાં ખૂબ જીણી જીણી વાતોને પણ સમજવાની છે. આવાં રહ્યાંથીને સમજવાનાં છે. તમો બધા આવા પ્રયત્નો કરતા રહો છો, તે આનંદની વાત છે. ઓમ્ભૂ ભગવાન આપણા સૌનું કલ્યાણ કરે, જ્યનારાયણ. અસ્તુ.

### ●તા. ૩.૮.૦૮ સોમવાર●

માઈક બરાબર ગોઢવણું છે.? બરાબર સંભળાય છે.? સત્યધર્મગુરુદેવ ની જ્ય. કેટલાં માણસો આવેલાં છે? વીસેક ભક્તો છે? સૌનું સ્વાગત-નારાયણ -શુભ આશિષ. આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે. વધારેમાં વધારે શ્રવણ કરવાનો મહિનો. એક દોહરો છે. તેના પર થોડું બોલીશું.

એક લાલા પૂજા મેં રાખત, એક બધિક ઘર પરો, યહ દુવિધા પારસ નહીં જીનત, કંચન કરત ખરો.

એક લોખંડનો ટુકડો મૂર્તિના સ્વરૂપે-પૂજામાં મુકેલો છે. બીજો એક ટુકડો ભાલા સ્વરૂપે- તીર સ્વરૂપે શિકારીના ઘરમાં પડેલો છે. છે તો બને લોખંડના ટુકડા, પણ એક ટુકડો મૂર્તિ સ્વરૂપે છે- તેની પૂજા થાય છે. બીજો તીર સ્વરૂપ- ભાલા સ્વરૂપે છે અને શિકારી તેના વડે શિકાર કરે છે, હિંસા કરે છે. પરંતુ યહ દુવિધા પારસ નહીં જીનત, દુવિધા કહેતાં બેદ, પારસમાણના મનમાં બેદ નથી. એ તો જેને સ્પર્શ થાય તેને સૌનું કરી નાખે.

ગુરુસંતોના સંપર્કમાં આવનાર સૌનું તેઓ કલ્યાણ કરે જ છે પછી તે પુરુષ હોય કે સ્ત્રી, ધનવાન હોય કે ગરીબ, આ જીતિનો છે કે પેલી જીતિનો તેની સાથે તેમને કંઈ નિસ્બત નહીં. સંતોનો સ્વભાવ જ એવો હોય છે. આ

બહુ ઊંચી અને સમજવા જેવી વાત છે.

એક ભગવાનની મૂર્તિ છે અને બીજું શિકારનું સાધન ભાલો-બાળ છે એવો ભેદભાવ પારસમણિના મનમાં નથી, એ તો બંનેને લોઢા સ્વરૂપે જ જુંએ છે. પોતાને સ્પર્શનાર લોઠાને પારસમણી સોનું બનાવી જ હેલે.

મુક્તાનંદ બાબાની એક વાત યાદ આવે છે. તેઓ ગુરુશ્રી નિત્યાનંદ બાબા પાસે બેસે. નિત્યાનંદબાબા તો મસ્તિફીર. ખૂબ મોટું શરીર-ઊંચા અને કદાવર-રંગે શ્યામ. પગ સાવ પાતળા અને મોટું પેટ. એમના આસન પર બિરાજમાન હોય ત્યારે, કલાકોના કલાકો એક જ મુદ્રામાં હોય, ઊંચે આકાશમાં નજર માંડી હોય તો, એમને એમ કલાકો નીકળી જાય. એમના દર્શન માટે હજાર-હજાર માણસ લાઈનમાં ઉભાં હોય. મુક્તાનંદજી તેમના આસન પાછળ, ઓરડાના એક ખૂશામાં પાછળ સંતાઈને ઊભા હોય, અને બધું જોયા કરે. ગુરુજીને બાબાની જરૂર પડે તો હું... એવો હુંકાર કરે એટલે બાબા ગુરુજીની પાસે આવે, ઈશારાઓમાં વાતો થઈ જાય અને બીજો હુંકારો કરે એટલે બાબા પોતાની જગ્યાએ ચાલ્યા જાય. લાઈનમાં ઉભેલાં સૌ નિત્યાનંદબાબાનાં દર્શન કરવા - તેમની નજરની એક જલક મેળવવા માટે કલાકો સુધી ઊભાં રહે. બધાં દુઃખિયારાં હોય, નમસ્કાર કરે, પોતાનું જ હુંઘ હોય, તેની વાત કરે. કોઈને સંતાનનું દુઃખ, કોઈને કોઈમાં કેસ ચાલતો હોય. બાબા તો પોતાની

મસ્તીમાં હોય. મુક્તાનંદજી પાછળ ઊભા રહીને બધું જોયા કરે. મનમાં વિચારે કે બહારની દુનિયામાં તો લોકો ખૂબ સુખી હોય એવું લાગે છે, પણ ગુરુજી નિત્યાનંદજીની પાસે તો પોતાની કંઈક માંગણી લઈને જ આવે છે. મોટા એકટર હોય, મોટા શેઠ હોય, કંપનીના ઓફિસર હોય, સમાજના પ્રતિષ્ઠિત આગેવાન હોય. દરેક ને કંઈ ને કંઈ ફરિયાદ છે, બધાં દુઃખી જ છે, કોઈ સુખી નથી. આ બધું જોઈને મુક્તાનંદબાબાને હવે જગત તરફ મોષ ના રવ્યો. ગુરુજીના સાનિધ્યમાં બેસવાથી એમને પાકી ખાતરી થઈ ગઈ કે 'જગતમાં બધું આમ જ છે. જગત બધું આમ જ છે.' તેજાને ટકોર. ગુરુસંતોનું સાનિધ્ય મળે તો કલ્યાણ થઈ જાય. પણ ગુરુસંતોના સાનિધ્યમાં બેસવાનું કચારે મળે? એના માટે અધિકારી બનવું પડે. બાકી ગુરુસંતો તો આપણને પાસે આવવા જ શાના દે? આપણને પાસે બેસવા જ શેના દે?' એમને તો કોઈની ય સેવા લેવાની હોય જ નહીં માટે આપણે સાચા અધિકારી બનવું પડે. અધિકાર પ્રાપ્ત કરી લેવો જોઈએ.

ભગવાનની દ્યાથી તમો સૌ આત્મકલ્યાણનું કામ કરો જ છો.

સત્યધર્મગુરુદેવ કી જ્ય.જ્ય નારાયણ

**સાહિબ સબકા બાપ હે, બેટા કિસીકા નાહીં  
જો કિસીકા બેટા હે, વહ સાહિબ નાહીં.**

## જીવન પાથેય

**યુવાનીનો લહાવો :-**

યુવાનીમાં અમેરીકા જેવા દેશમાં રહેવા મળે એ એક લહાવો ગણાય. કેમકે અમેરિકા અતિ પરિશ્રમ કરનારો દેશ છે. યુવાનીમાં કાંઈક કરી છુટવાની - ખૂબ પરિશ્રમ કરવાની તમજા હોય છે. એ તમજાને તે જ પૂરી કરી શકે જે ખૂબ પરિશ્રમ કરનારો અને પરિશ્રમમાં માનનારો હોય.

**ઢાતી ઉંમરનું સંદર્ભભાગ્ય :-**

૫૦ વર્ષ પછીની ઉંમર વળતા પાણી જેવી ગણાય, ઠરેલ ઉંમર ગણાય, એ ઉંમરમાં બધાં ઝંગાવાતો સમી ગયા હોય છે, જીવનના સારદૃપ એવી કોઈ અલોકિક દિવ્ય તત્વની આણી-આણી પ્રાપ્તિ- ઓળખ થઈ હોય છે. ઠરેલ ઉંમરને - ઠરેલ સ્વભાવને શાંતિની ઝંખના હોય છે. નશીલી - ઝંગાવાતી યુવાનીમાં ખૂબ ખૂબ બહિરૂખતાનો આસ્વાદ લઈલઈને યુવાની થાડી-કંટાળી-ઉબી ગઈ હોય છે. તે વખતે તેને ઠરેલ આધ્યાત્મિક વાતાવરણમાં રહેવાની ભૂખ પણ હોય છે. તે બધું ભારતદેશ જ પૂરુ પાડી શકે. તેથી પચાસ વર્ષ ની ઉંમર પછી ભારતમાં રહેવા મળે તો તે મહાસંદ્રભાગ્યની નિશાની ગણાય.

-યોગમિક્ષુ

## પત્રાંશ

પરમ આદરણીય ગુરુજી

(૧) ઓમું પરિવાર ટ્રસ્ટ દ્વારા સમાજને બ્રમો અને ભાંતિમાંથી મુક્ત કરવા સતત ચિંતન, મનન તથા સાહિત્ય દ્વારા ઉજાગર કરવાનો યજ્ઞ કરવા માટે જીવનની ક્ષણે ક્ષણ માટે પ્રયત્નશીલ. તમને હદ્દયપૂર્વક પ્રણામ.

(૨) તમારો કુદરતી ઉપચાર, ગ્રાહૃતિક જીવન શૈલી માટેનો અનુરૂપ સમાજને આશીર્વાદરૂપ છે. જ્ઞાન-યોગ-ભક્તિનું તમારું અર્થધારન જ્ઞાન-બોધપાઠ સાથે રમ્ભુજ પણ છે.

(૩) દવા કરતાં ઉપવાસ કરવો એ શુષ્ય કુદરતી ઉપચાર છે તે જીવનશૈલીમાં પરિવર્તન - મો. વી. પી. ગીદવાણી આદુ પણ ન લેતા ફૂત્રિમ ભૂખ ઊભી કરવામાં ન માનતા.

(૪) ડે. ભમગરાજ મોતિયાના ઓપરેશન કરાવ્યા વગર જીવ્યા. જંતુઓ પર પ્રયોગો કરીને શોધાતી દવા આંખમાં મૂકૃતા નહીં.

(૫) શ્રી ગોયેન્કાળ પદ્ધનામાં ધર્મ એટલે હું, પછી મારો પરિવાર પછી મારો સમાજ-દેશ અને વિશ્વ શાંતિથી, સુખથી સ્વસ્થ રહેતે અનિગમ માટે બોધ આપે છે.

કલાઓ ધંધી છે. તેમાં શ્રેષ્ઠ જીવન જીવવાની કલા. ખૂબ આભાર.

લિ. કાન્તિ દેસાઈના હદ્દયપૂર્વક પ્રણામ છાપરા રોડ, નવસારી.



માનનીય શ્રી યોગભિક્ષુજી,  
આપના તરફથી ગુરુપૂર્ણિમા ઉપર ગુરુપૂજન માટે આવવાનું નિમત્તણ મળ્યું.

આવવાની ખૂબ ઈચ્છા છે; પરંતુ શરીર હવે પરમિશન આપે તમ નથી. મારી માનસિક ઈચ્છા ગુરુપૂજનમાં ઢાજરી સાથે આપને મળવાની ઈચ્છા હોય છે. ગુરુપૂજનમાં આવેલ સર્વ સદ્ગૃહોર્થોને. મારા સેહવંદન.

લિ. જીવુભાઈ પ્રદીપ, (હળવદ)

**ત્રણતમ્મરાના ઓક્ટોબર-૦૯ ના “ઓછામાં ઓછાં બે બાળકો” “પછી તે પુત્ર હોય કે પુત્રી”  
લેખના વાક્યને અનુલખી ને.... ગુરુજીને સપ્રેમ....**

એ આવશે તો ખરી જ, મારે રાહ જોવાની છે.

યાદ છે.... મને

છેલ્દે ખોળામાં માથું નાંખીને

અંતિમ શાસે મોકલ્યો તો કહીને કે,

“હું જ બનીશ તમારી, આવતા ભવમાં પણ”

તો પણ કેમ???

“હા” પણ મારી જેમ અને થોડી નવરાશ હશે?

યાદ છે.... મને

એ આવી હતી,

ગુલાબ છોડ પર આવતી પહેલી કળીની જેમ,

ઓક્ટોબર-૨૦૦૯

● તા. ૨૪.૦૭.૨૦૦૯, શનીવાર ●

આપશ્રીએ શ્રી ભગીની મંડળ, કાલીકટ ને મોકલેલ ગ્રાહક નંબર-૨૧૦૮ અંક વર્ષ-૨૬ (જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર) XXVI-09-10 ઈસ્યુ-૧ મને વાંચવા મળ્યું અને એ વાંચીને હું ખૂબજ પ્રભાવિત થયો મને એ જ અંક (જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર) થી ગ્રાહક બનાવશો તો આપશ્રીનો ખૂબ જ આભાર માનીશ, તે સિવાય ઓમ્પરિવાર, ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત મકાશનોમાં ગુજરાતી વિભાગમાં ૧૧- મી પુસ્તિકા ‘મારે સમાજને બેઠો કરવો છે,’ બીજી આવૃત્તિ, જેની કીમત રૂ.૬/- દર્શાવેલ છે એ પુસ્તિકા પણ મને વહેલી તક ઉપરના સરનામે મોકલી આપશો, એવી આશા રાખું છું તો, વાંષિક લવાજમના રૂ. ૩૦/- અને પુસ્તિકાની કીમત રૂ.૮/- એમ કુલ રૂ.૩૮ નો ડ્રાઇટ ઓ. પ્રે. પ. ટ્રસ્ટના નામે મોકલી રહ્યો છું.

તા.ક.જવાબી પોસ્ટકાર્ડ સંલગ્ન છે, વહેલી તક મને મારો ગ્રાહક નંબર જણાવશો.

એ જ લી આપનો એલ.એન.જીની- હરિઓમું  
◆ ◆ ◆ ◆ ◆

પૂ.શ્રી.યોગભિક્ષુજી,

સમસ્ત ઓમ્પરિવારનું ગુરુપૂર્ણિમા નિમિત્તે નિમત્તણ મળ્યું.

(૧) જ્ઞાન, યોગ અને ભક્તિ કોને કહેવાય?, (૨) લાખ દુઃખોકી એક દવા, (૩) કર્મનો અટલ નિયમ, (૪) ગુરુ પ્રેમ-સમર્પણ-ધ્યાન, (૫) અનુશૂસન, (૬) જીવનપાથેય અને (૭) મન દુરસ્ત તો તન દુરસ્ત

વાંચી અને ખૂબ આનંદ થયો આજ ઉત્તમ ગુરુપ્રસાદ મારા માટે.

બસ એ જ લી.  
દિલજિત ચ. શાહ, ના હરિ ઓમ

ઓછામાં ઓછાં બે બાળકો” “પછી તે પુત્ર હોય કે પુત્રી”

લેખના વાક્યને અનુલખી ને.... ગુરુજીને સપ્રેમ....

ઉગતી રહી ને ખીલતી રહી... . ’ને

પરિણય એનો પરિણય બનતાં પરિણય બની ગયો તો.

ઇતાં....

એ જ હો ઉન્માદ એનો મારા પ્રત્યેની લાગડીનો....

છા, યાદ છે.... મને

અંતિમ શાસે, મોકલ્યો તો કહીને કે,


“હું જ બનીશ આવતા ભવમાં પણ

દીકરી તમારી” તો પણ કેમ???

(પરિણય = પ્રેમ, પરિણય = ઓળખ, પરિણય = લગ્ન)

આજાંકિત આપનો, પહ્લવ

आश्वर का बोधक (नाम) प्रणव/ओम् है।



( समाजिकाद के दूसरों का वापसीकार )

- (२४) कलेज, कर्म, कर्मफल और वासना जिसमें नहीं है ऐसा पुरुषविद्रोष/चेतनविद्रोष जीवर है।
  - (२५) जीवर संपूर्ण सर्वज्ञ है।
  - (२६) जीवर पूर्वकाल के गुरुओं के भी गुरु है और काल की मर्यादा से (जन्म—मृत्यु से) पर है।
  - (२७) जीवर का नाम प्रणय/ओम् है।
  - (२८) अर्थ के चिन्तन सहित ओम् का जप करना।
  - (२९) चिन्तन् सहित जप करने से अन्तरायों का अभाव और अन्तरायाभाव होता है।

સાધુવીની પત્રોની વિદેશી માલી-૧૬૮૩૩

### ● ડુર્ગા ઉદેશો :-

- (१) सर्वव्यापक परम सूक्ष्म योतन तत्त्व के बेनुं नाम प्रणाल (ओम् -ॐ) छे तेनी प्रतीति बहुजनसमाजने कराववा मयल करवो. (२) 'योग' नो प्रयाट, प्रसार अने संशोधन करवा मयल करवो. (३) समाजनुं गैतिक धोरण उँचुं लाववा माटे आध्यात्मिक ज्ञाननो साहित्य द्वारा प्रयाट अने प्रसार करवानो प्रयल करवो. (४) आ उपरांत 'बहुजनहिताच-बहुजनसभाय' ने लगतां कार्यो जेवां के केळवणी, तजीी सारवार वगेटे करवा माटे प्रयल करवो.

Registrar of News Papers of India under Regd. No. 48770/90  
L-5/131/QTY/34/90-91

To,

આધ્યાત્મિક તથા આર્થાત્તિક દસી

પ.પુ. ગુરુદેવ શ્રી યોગબિન્દુજી

PRINTED & PUBLISHED BY :-

Dr. S.S. Bhikshu for

AUMGURU PREMSAMARAPANDHYANBHIKSHU PARIVAR TRUST

(Reg. No. E/4416 Date 11-5-81)

From :- 3/B, Palladnagar Society, Nararpura, Ahmedabad.

Printed at : Shree Graphics, Navrangpura, Ahmedabad.

Hon. Editor : Naishadh Vyas

I.T. Exe. DIT(E)/80G(5) / 252 / 2008-09 ( Up to MARCH-2013)

લવાજમ દર :-

વાર્ષિક સભ્ય (ભારતમાં) ... રૂ. ૩૦-૦૦  
આજીવન સભ્ય (ભારતમાં) ... રૂ. ૫૦૦-૦૦  
વાર્ષિક સભ્ય (પરદેશમાં) ... \$ ૧૫.૦૦  
આજીવન સભ્ય (પરદેશમાં) ... \$ ૧૫૧.૦૦

લવાજમ મોકલવાનું તથા

"એતભરા"ને લગતો પ્રાચ્યવિદ્યાર  
કસ્ત્વાનું રેણુ :-

(૧) ડૉ. સોમાભાઈ એ. પટેલ

૩/૧, પલિયડનગર  
સેન્ટ જેવિયર્સ હાઇસ્ક્વુલ રોડ,  
નારાણપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૧૩

(૨) નેપદાભાઈ સી. વ્યાસ

"સ્વાશ્રય",  
૩, ગંગામરા સોસાયટી,  
રામબાગ પાછણ, મણીનગર,  
અમદાવાદ - ૩૮૦ ૦૦૮

સૂચના :-

(૧) લવાજમ થેક કારા અથવા મનીઓર્ડર  
કારા "ઓ. એ. પ. ટ્રસ્ટ" ના નામે  
મોકલવું. તાથે આપણું પુરું નામ,  
સરનામું થુલ અસરોમાં લખી મોકલવું.

(૨) જે સભ્યનાં રહેઠાશનાં સ્થળ બદલાયાં  
શેય તેમણે તેમના નવા રહેઠાશનું પુરું  
સરનામું લખી પોકલવું જેથી  
વ્યવસ્થાપકોને અંક પોકલવામાં  
સરળતા રહે.

પ.પુ. ગુરુદેવ શ્રી યોગબિન્દુજી  
સાયેના સંસ્કરણો તથા પ્રેરક  
પ્રસંગો આપકાર્ય છે.